


# જૈન દીક્ષા અંગે પત્રકારોનું વદળા



બાયામાન વાચેસ્પતિ પૂજયપાદ આચાર્ય જી  
શ્રીમહેનું વિજય મધ્યાંક્ષેત્રોથ્રે મહારાજા

અને  
નાના આગામી વિ  
નાની આગામી વિ  
નાના રૂપ લીધું તારે પોકાર  
નાના રૂપાંશી ખાદી સરકાર  
પણી કરવાની આવસ્કાતા  
યાણને જીવાઈ હતી અને તેથી ચોમેરોણી  
માળાણો થઈ હતી.

અને  
નાના આગામી વિ  
નાની આગામી વિ  
નાના રૂપ લીધું તારે પોકાર  
નાના રૂપાંશી ખાદી સરકાર  
પણી કરવાની આવસ્કાતા  
યાણને જીવાઈ હતી અને તેથી ચોમેરોણી  
માળાણો થઈ હતી.

પૂજયપાદ આચાર્ય શ્રીવિજયરામચન્દ્રસૂરી સ્મૃતિ ગ્રંથમાળા... ૭૫

# જૈનદીકા અંગો પત્રકારોનું વલણ

❖ પ્રવચનકાર ❖

સુવિશ્વાણ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ,  
પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય  
રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા



❖ સંપાદક ❖

વર્ધમાનતપોનિધિ પૂજય મુનિરાજશ્રી ગુણયશવિજયજી ગાણીવરના શિષ્યરન  
પૂજય મુનિરાજશ્રી કીર્તિયશવિજયજી ગાણીવર

### ★ પ્રકાશક :

#### સત્તમાર્ગ પ્રકાશન

સે. મૂ. તપાણથી કેન આરાધના ભવન,  
પાદીયાની પોણ, રીલીફ રોડ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૧  
મુદ્રક : ગુજરાત એન્ફસ્ટેટ, અમદાવાદ  
સર્ટિંગ : હુન્ડુભિ પ્રિન્ટર્સ, ૦૭૯-૪૦૪ ૧૮૬

### મૂલ્ય :

એક પુસ્તકની કિંમત : રૂ. ૦૦૦

૨૧ પુસ્તકના પહેલા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦

૨૨ પુસ્તકના બીજા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦

૨૨ પુસ્તકના બીજા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦

૨૨ પુસ્તકના ચોથા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦

૧૦૮ પુસ્તકના પુરા સેટની કિંમત : રૂ. ૬૨૫-૦૦

પ્રથમ આવૃત્તિ-નકલ ૩૦૦૦, વિ. સં. ૨૦૫૧ અધ્યાં વદ ૧૪ તા. ૨૬-૭-૮૫ બુધવાર  
પૂરુષપાદ ગાયાદિપતિ આ.શ્રી વિજયસામયન્દ્રસુરીશર્જન મહારાજાનો ચોથો વાર્ષિક સર્વરોહન દિન

સૌજન્ય : શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ

### ★ સંપર્કસ્થાન - ● પ્રામિસ્થાન :

#### અમદાવાદ ફોન:

- ★ બાબુલાલ કક્ષલાસ શાહ - ટ્રસ્ટી  
C/o. શાંતિલાલ બાબુલાલ એન્ડ કુ.  
રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧  
ફોન : (૨૦૮) ૫૪૫૪૮૪૮, (૫) ૫૪૫૬૮૫૫
  - ★ કે. નીતિન & કુ.  
૨૧, આંદશોપોંગ સેન્ટર, રતનપોળ,  
ગોલવાડ, અમદાવાદ-૧, ફોન : ૫૪૫૬૩૮૦
  - શાહ હરિયંદભાઈ પ્રતાપયંદ - ચેરમેન  
૩૮, ચક્કાન સોચાયારી, શાંતિનગર, અમદા.  
ફોન : ૩૮૩૦૮૫, R.૬૪૨૦૧૫૮
  - ★ ડૉ. રમેશભાઈ શાંતિલાલ વોરા - મંત્રી  
ટેલરસાન પાદા સામે, કાલુપુર, અમદાવાદ-૧  
ફોન : ૩૮૬૩૦૩ (૬) ૪૫૬ ૪૫૬
  - શાહ વાઘજાહાઈ ભુદરભાઈ - સહમંત્રી  
સ્વામિનારાયણ મંદિર રોડ,  
કાલુપુર, અમદાવાદ-૧, ફોન : ૩૫૫૪૪૬
  - નરેન્દ્રકુમાર પોપટલાલ વોરા - સહમંત્રી  
જૈનનગર, પાલીયા, અમદા-૭ ફોન : ૪૧૦૦૮૭
- ❖ સુરત ફોન:
- ★ શાહ નવાનિયંડ તારાયંદ - મંત્રી  
C/o. વિપુલ શાહમંડ,  
૨૦૫-૨૦૬, આંદશ, બીકેમણ, જદાનાયી,  
મહીધરપુરા, સુરત, ફોન : ૫૩૭૫૦
  - શાહ પીરજીકુમાર શાંતિલાલ  
કેલાસનગર, સુરત ફોન : ૩૮૮૪૮
  - પરેશકુમાર વાલીલાલ સંઘરી  
નાયાવટ મેરીન રોડ, સુરત, ફોન : ૪૩૫૬૨૪  
❖ વડોદરા ફોન:
  - પ્રકાશયંડ જયંતિલાલ ગંધી  
C/o. સુલસ ટ્રાવેલ્સ, લાલજ કુર્ઝ,  
મસ્જાદ સામે, નાયાવટાં,  
વડોદરા-૧, ફોન : ૫૪૪૪૧, ૫૪૧૩૮૬  
❖ જામનગર ફોન:
  - સમીર કે. પારેખ  
૫, ગંધી ચોક, જામનગર  
ફોન : ૭૮૨૧૨ (અ), ૭૧૮૪૨ (૬)  
❖ રાજકોટ ફોન:
  - પ્રકાશભાઈ દોશી  
વધીમાનનગર જૈન ઉપાશ્રય,  
હજુર પેલેસ રોડ, રાજકોટ-૧

#### મુખ્ય ફોન:

- મહેતા જયંતકુમાર શાંતિલાલ - મંત્રી  
C/o. શાંતિલાલ એન્ડ સન્સ,  
૨, પહેલેમણ, કાચવાલ નિર્હીંગ,  
૫૩, પનજ સ્ટ્રીટ, મુખ્ય-૩  
ફોન : ૩૪૪૪૬૧૭, ૩૪૪૬૩૩૬
  - વીરવાણીયા પ્રકુલ્પકુમાર શાંતિલાલ  
૪૦૧/સી. ચંદ્રપુરી, કેદારમથ રોડ  
મલાં (પૂર્વ) મુખ્ય-૮૭  
ફોન : ૩૮૪૪૦૫૭૩૮-૪૪૦૩૮૨૦
  - ક્રયવત્ત એમ. જરેરી  
સુલસ એ. વાલકેયર ફોન : ૩૬૧૦૭૨૪
  - અનિલ કુમાર ડી. શાહ  
મહાજાન્સ, ૫૧૦, પ્રચાદ ચેઅસ્ટ,  
ઓપેરાંલાઇસ, મુખ્ય-૪  
ફોન : ૩૬૧૦૨૧૮-૩૬૧૧૮૮૨૮
  - દિલીપકુમાર એચ. શીવાળા  
બી-૩૭, સોનારિકા, ૨૫૨૮૮, ચંદાવાડી  
સી.પી. ટેક રોડ,  
મુખ્ય-૪, ફોન : ૩૮૮૩૮૧૦, ૩૮૬૮૧૨
  - સર્વતેલાલ વી. જૈન  
૨૦, મહાજનનગરી, ૧૬ે માળે, જરેરીબજાર  
મુખ્ય-૨
- ❖ નવસારી ફોન:
- રાજુભાઈ બી. શાહ  
રોકિઝ એપાર્ટમેન્ટ, પંચમે માળે, સેશન રોડ,  
નવસારી, ફોન : ૨૧૩૮, ૪૫૮૧
- ❖ નાસિક ફોન:
- ચંદ્રકાન્ત ચીનુભાઈ શાહ  
મેરીન રોડ, નાસિક-૪૨૨૦૦૧  
ફોન : ૭૬૪૭૨
  - વદ્વાશ - સુરેનનગર ફોન:
  - જયંતભાઈ લીલાલ શાહ  
ધનાજીગઢનું ડેલું, મોટા દેંગમર સામે,  
સુરેનનગર, ફોન : ૨૨૭૪૪ (અ)  
૨૧૯૧૬ (૬)
- ❖ સોલાપુર ફોન:
- પ્રકાશયંડ મોરીલાલ શાહ  
૫૮૬, ચારીગલી, સોલાપુર-૪૧૩૦૦૨  
❖ પાવિત્રાશ ફોન:
  - સોમયંડ ડી. શાહ  
જીવસનિવાસ સામે, તળાડી રોડ, પલીતાલું

## પ્રકાશકોના છૈયાની વાત

- ★ પરમ શાસનગ્રભાવક વાખ્યાનવાચસ્પતિ, સુવિશાળગચ્છાધિપતિ સંઘસ્થવિર, પૂજ્યપાદ આચાર્યદ્વારા શ્રીમદ્ વિજયરામયન્દ્રસૂરીશ્વરજી મહારાજાને પોતાની અમોદ દેશના શક્તિ દ્વારા સકળ શ્રીસંધ ઉપર અને વર્તમાન વિશ્વ ઉપર કરેલા અગ્નિકિત ઉપકારોથી કોણ અજાણ્યું છે ?
- ★ નશર દેહે તેઓ શ્રીમદનું સાનિધ્ય આજે અલાભ્ય બનવા છતાં પણ અકાર દેહે તો તે સાનિધ્ય આજે પણ અટલું જ સુલભ છે. આમ છતાં અને વધુને વધુ સર્વજન સુલભ બનાવવા અને એ દ્વારા જીવનભર તેઓ શ્રીમદ્ અવિરતપણે વહેણે વહેણે ઉપકાર ભાગીરથીના નિર્ભળ વહેણને અવિરતપણે વહેણું રાખવા સન્માર્ગ પ્રકાશને ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદ્વારા શ્રીમદ્ વિજયમહોદ્યસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશીર્વાદ પામવા પૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામયન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપકારે દર વર્ષ તેઓશ્રીજના વાર્ષિક સ્વર્ગરોહણ દિને ૨૧/૨૨ એમ કુલ પાંચ જ વર્ષના ટુંકા ગાણામાં ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાનો નિર્ધાર કર્યો છે. અમારા આ નિર્ધાર મુજબ પૂજ્યશ્રીજના પ્રથમ સ્વર્ગરોહણ દિને ૨૧ પુસ્તકોના ગ્રંથ-ગ્રંથ હજાર સેટનું બે આવૃત્તિમાં પ્રકાશન કર્યું હતું. એજ રીતે પૂજ્યપાદશ્રીજના બીજા સ્વર્ગરોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૨૨થી ૪૩ એમ ૨૨ પુસ્તકોના બીજા સેટનું અને ત્રીજા સ્વર્ગરોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૪૪થી ૬૫ એમ ૨૨ પુસ્તકોના ત્રીજા સેટનું પ્રકાશન કર્યા બાદ તેઓશ્રીજા ચોથા સ્વર્ગરોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૬૬થી ૮૭ એમ ૨૨ પુસ્તકોના ચોથા સેટનું પ્રકાશન કરતાં અમને અત્યંત આનંદભૂતિ થાય છે.
- ★ પ્રસ્તુત ગ્રંથમાળાના પત્રેક પુસ્તકોનું સંકલન/રાંપાદન કરી આપવા અને વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી ગણીવરના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણીવરને વિનંતિ કરતાં અમારી તે વિનંતિને સહર્ષ સ્વીકારી અમને અત્યંત ઉપકૃત કર્યા છે.
- ★ સ્મૃતિ ગ્રંથમાળાના ‘શૈનદીકા’ અંગે પાત્રકારોનું વલણ પુસ્તકને પ્રકાશિત કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે પ્રસ્તુત પુસ્તકનું વાંચન આપના જીવનને સારી દિશા અને સારો પ્રકાશ આપશે. આપ અને માત્ર કબાટની શોલા ન બનાવતાં આપના જીવનની શોલા બનાવશો અને એને સરોવરના જળની જેમ એક જ જગ્યાએ સીમીત ન રાખતાં નિર્ભળ સરિતાના વહેણની જેમ વહેણું જ રાખશો. આપની અનુભૂતિ અમને જાણવા મળશે તો અમારો આનંદ અદકેરો બનશે.

- સન્માર્ગ પ્રકાશન

# અર્પણ સવિનય સમર્પણ

પરમ આપત્તવને વરેલા હે ગુરુદેવ !  
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજ્ય  
રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !

ગુજર ભાષાના માધ્યમે આપે વહેતી મૂકેલી  
પ્રવચન ભાગીરથીને  
સુયોગ્ય જ્ઞાનાર્થીજનો સુધી  
પહોંચાડવાનું જે સૌભાગ્ય  
અમને પ્રાપ્ત થયું છે,  
તે... અમને પ્રાપ્ત થયેલા  
આપના અંતસ્તલના આશીર્વાદનું જ  
એક સુખદ શુભ પરિણામ છે.  
આશા તો એક જ હતી કે,  
સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમા  
આપના વરદ કરકુમળોમાં સ્થાન માપિને  
આ જ્ઞાનલક્ષ્મી ઝૂભી ઊઠશે :

પણ... ગુરુદેવ !

અમારું એ પુરુષ ઓછું પડ્યું અને આપ સર્વો સિધ્ધાવી ગયા.  
ખેર ! આપ જ્યાં હો ત્યાંથી પુષ્પમાળા સમી  
આ ચંથમાળા સ્વીકારી અમને કૃતાર્થ કરો એ જ એક અત્યર્थના.

## ાધાર સ્થંભ :

સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મિયભાવે અત્યંત મહત્વનો ફણો આપી આધારસ્થંબ બનનારા પુષ્યવાનોની શુભ નામાવલિ.

૧.	ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હૃતીલાલ	મુંબઈ
૨.	હસમુખલાલ ચુનીલાલ મોદી	મુંબઈ
૩.	રમીલાલેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ	મુંબઈ
૪.	માણેકલાલ મોહોલાલ જ્યેશ્વરી	મુંબઈ
૫.	ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ : વાડીલાલ	સુરત
૬.	ભોરોલતીર્થ નિવાસી વોહેરા જેવતલાલ સ્વરૂપચંદ	ભોરોલતીર્થ
૭.	શાહ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ	મુંબઈ
૮.	શ્રીમતી કંચનબહેન સારાભાઈ શાહ હ : વિરેન્દ્રભાઈ (સાઇન્ટીફિક લેઝ.)	અમદાવાદ
૯.	જ્યેશ્વરી કુમારપાળ બાલુભાઈ	મુંબઈ
૧૦.	શાહ જોઈતાલાલ ટોકરદાસ હ : શાહ દિનેશભાઈ જે.	મુંબઈ
૧૧.	શાહ છલ્લીલદાસ સાંકળચંદ પરિવાર	મુંબઈ
૧૨.	શાહ ભાઈલાલભાઈ વર્ધીલાલ (રાધનપુર) C/O. શાહ રાજુભાઈ જી.	નવસારી
૧૩.	ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજુભાઈ હ : ચંપકભાઈ	સુરત
૧૪.	શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા)	સુરત
૧૫.	સંઘવી શાંતિલાલ વાડીલાલ	ભાબર
૧૬.	શાહ બાલુલાલ મંગળજી પરિવાર	ઉંબરી
૧૭.	શ્રીમતિ કંચનબહેન કાન્તિલાલ મણીલાલ જ્યેશ્વરી હસ્તિગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિસે	પાટણ
૧૮.	પાલનપુર નિવાસી શાહ શશીકાન્ત પૂનમચંદ	મુંબઈ
૧૯.	શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા	મુંબઈ
૨૦.	શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા	મુંબઈ
૨૧.	જ્યેશ્વરી જીતુભાઈ જ્યેરચંદ	મુંબઈ
૨૨.	શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા	મુંબઈ
૨૩.	ધાનેરા નિવાસી શાહ ચંદનબહેન કનૈયાલાલ હ : નરેશભાઈ	નવસારી
૨૪.	સુરીલાલેન પ્રતાપભાઈ દલાલ	પાટણ

## : સહયોગી :

સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો  
ફળો આપી સહયોગી બનનારા પુષ્યવાનોની શુભ નામાવલિ.

૧.	હેમચંદભાઈ મોતીચંદભાઈ જવેરી	મુંબઈ
૨.	અમૃતભાઈ પૂનમચંદભાઈ મહેતા પરિવાર C/O. કુમારભાઈ થો. મહેતા	સુરત
૩.	રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા C/O. અરવિંદભાઈ આર. શાહ	સુરત
૪.	સંઘવી સોહનરાજજી રૂપાજી	મુંબઈ
૫.	શ્રીમતી નિર્મલાભહેન હિંમતલાલ દોશી ઉ : શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી	મુંબઈ
૬.	શ્રી કેશવલાલ દલપતભાઈ જવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ જવેરી	મુંબઈ
૭.	સ્વ. મણીલાલ નીહાલચંદ શાહ ઉ : રતીલાલ મણીલાલ શાહ	મુંબઈ
૮.	ભાંડોતરા નિવાસી સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા તેમના ધર્મપતની પારુલભહેન મૂળચંદ સહપરિવાર	ભાંડોતરા
૯.	સ્વ. શ્રી ભીખમચંદજી સાંકળચંદજી C/O. શાહ રતનચંદ કુલચંદ	મુંબઈ
૧૦.	શાહ પારુલભહેન મચાચંદ વરધાજી	જેતાવાડા
૧૧.	શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા ઉ : પ્રવિષાભાઈ	સુરત
૧૨.	શ્રીમતી જયાભહેન પાનાચંદ જવેરી ઉ : પાનાચંદ નાનુભાઈ જવેરી	મુંબઈ
૧૩.	શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા	સુરત
૧૪.	શાહ બાલુલાલ નાગરદાસ પટોસણ(ઉ.ગૃ.)વાળા	મુંબઈ
૧૫.	શાહ અમીચંદ ખીમચંદ પરિવાર ઉ. : યોગેશભાઈ તથા નિકુંજભાઈ	મુંબઈ
૧૬.	શાહ માણેકલાલ નાનચંદ	મુંબઈ
૧૭.	શાહ બબાલાલ ડાહ્યાભાઈ રોકાણી (જૂનાડીસાવાળા)	મુંબઈ

## જૈનદીક્ષા અંગો પત્રકારોનું વલણ

વડોદરા રાજ્ય તરફથી પ્રગટ થયેલ 'સન્યાસ દીક્ષા પ્રતિબંધક' નિબંધને ટેકો આપતો એક લેખ તાર ૨૦ 'ઓગસ્ટ : ૧૯૭૧ના 'સન્યાસ વિજય' પત્રમાં તંત્રીસ્થાનેથી પ્રગટ થયો. લેખ સત્યથી વેગળો ને ગેરસમજભયો હોઈ, અને 'સન્યાસ વિજય' વડોદરામાંથી જ પ્રસિદ્ધ થતું હોઈ રહ્યા અને પ્રજામાં પવિત્ર 'જૈન દીક્ષા' વિષે બેઠિલી ને ગેરસમજ ન ફેલાય, એ હેતુથી પાટણના ધર્મનુંસારી જૈનોની વિજ્ઞાપિતી પૂર્ણ બાલબ્રહ્મચારી, સમર્થ વિદ્વાન વ્યાખ્યાનવાચસ્પતિ પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરે (પૂર્ણ આ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીભરતજી મહારાજે) એ લેખમાંની ગેરસમજે દૂર કરતું એક જાહેર પ્રવચન પાટણમાં તા. ૨૧-૮-૧૯૭૧ ને શુક્રવારે આયું હતું.

આ પ્રવચનમાં શ્રીમદ્, 'પ્રજ્ઞામિત્ર કેસરી' જેવાં અજ્ઞાન અને ધર્મદ્વિષથી દોરવાયેલ હોઈ ભાગવતી જૈન દીક્ષા સામે તદ્દન ખોરી ટીકા કરનારાં પત્રો માટે પણ કહેવા યોગ્ય કહ્યું હતું તેમજ 'જૈનદીક્ષા' અંગે કરાતા આક્રોષે પુરવાર કરવાનું આહવાન પણ કર્યું હતું. આ વિવેચન 'જૈનદીક્ષા' સંબંધી બહારના વાતાવરણથી દોરવાઈ ગયેલાની સમક્ષ એક એવી સૃષ્ટિ ખરી કરે છે, કે જેથી વાચકની ખોરી માન્યતાઓ લુપ્ત થાય એ પ્રવચનનું આ સારભૂત અવતરણ છે—પ્ર.

આજથી આશરે -૫૦-૫૫ વરસ અગાઉના દેશકાલમાં પૂર્ય પ્રવચનકારશ્રીએ ફરમાવેલા આ પ્રવચનના વિચારો, બાલદીક્ષાને નામે થતા અવળા પ્રચારના પ્રતિકારમાં આજે પણ એટલા જ પ્રાસારીક લાગવાથી અત્યારે એનું પુનઃ પ્રકાશન કર્યું છે.

## આસ્તિક શું સમજે ?

આજે શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી સર્વોત્તમ પ્રગત્યા સામે જે જે આકમણો થઈ રહ્યાં છે, તે કેટલાં બધાં બનાવવી અને ઉપજાવી કાઢેલાં છે, તે સમજાવવા માટે અને 'જૈનદીક્ષા'ની મહત્ત્વ કેટલી છે, તે બતાવવા માટે 'જૈનદીક્ષા' એ વિષય રાખ્યો છે.

શ્રી જિનેશ્વરદેવોએ જે દીક્ષાનો ઉપદેશ આય્યો છે, તે પોતે પોતાના જીવનમાં જીવીને, નહિ કે કેવળ બીજાઓ માટે જ. બીજી વાત એ છે કે એના વિના આત્મા ધારે તો પણ મુક્તિ સાધી શકે એમ નથી, તે માટે એને ઉપદેશી છે. અત્યાર સુધી જે આત્માઓએ મુક્તિ સાધી છે, તે એના જ પ્રતાપે. શ્રી જિનેશ્વરદેવોની દીક્ષા, એટલે દુનિયાભરનું ઊંચામાં ઊંચું શિક્ષણ કહીએ, તો પણ ચાલી શકે છે. જીવનને સારું ને સુંદર બનાવવા માટે યોગ્ય શિક્ષણ આપવું એનું નામ જ 'જૈનદીક્ષા' છે.

દીક્ષાની પ્રાપ્તિ તેને જ થાય છે કે જે આત્મા યોગ્ય બની ચૂક્યો છે અગર યોગ્ય બનવા પ્રયત્ન કરે છે. આસ્તિક દુનિયા, કે જે સંસારને અનાદિ માનનાર છે, અનાદિકાળથી આત્મા રખડે છે અને કર્મને લીધે આત્માની ચર્ચતી-પડતી થયા કરે છે એમ માને છે; તેને માટે એ પ્રશ્ન જ અસંભવિત છે કે અમુક આત્માને કેમ દીક્ષાની ભાવના થાય ? કે દીક્ષાની ઉત્તમતા કેમ સમજી શકાય ?

## શું વિચારવું છે ?

જૈનદીક્ષા, એ કોઈ ભયંકર વસ્તુ નથી, એટલું જ નહિ પણ એક સારામાં સારી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. દુનિયાના જેટલા પાપવ્યાપારો છે, તેને તજવા અને સદ્ગુરુઓની નિશ્ચા સ્વીકારી, એમની આજ્ઞા મુજબ શક્તિ હોય તેટલા પ્રમાણમાં ઉત્તમ આચારોનું પાલન કરવું અથર્ત્વ-કોઈ પણ આત્માને મનથી, વચનથી કે કાયાથી દુઃખી કરવો નહિ, કરાવવો નહિ અને કરતા હોય એને સારા માનવા નહિ. એ જ રીતે અસત્ય, ચોરી, સ્ત્રીસંગ, ધનધાન્યાદિ પરિગ્રહ સેવવા નહિ, સેવરાવવા નહિ અને સેવતાને ભલા માનવા નહિ, એનું જ નામ જૈનદીક્ષા છે.

હિંસા, જૂઠ, ચોરી, વિષયની વાસના અને પરિગ્રહ-એ પાંચે જગતને

તુખાડનાર, પાયમાલ કરનાર અને અધોગતિએ પહોંચાડનાર મહા દોષો છે, એવું જગતમાં ક્યો બુદ્ધિમાન્ નહિ સ્વીકારે ? એનો ત્યાગ એનું જ નામ જૈનદીક્ષા. એની સામે આકમણ લાવવાનું કાંઈ પ્રયોજન છે ? નથી જ. તે છતાં રાજ્યો તરફથી પ્રતિબંધની વાતો થાય છે, એનું કારણ એ જ છે કે પાપની વૃત્તિથી ભારોભાર ભરેલા આત્માઓએ આજે એ સ્વપર તારક દીક્ષા સામે ખોટું પ્રચારકાર્ય આરંભ્યું છે, નહિ તો જૈનદીક્ષા, એ રાજ્ય તથા પ્રજા ઉભય માટે શાંતિને આપનાર છે.

ખૂનીઓને રોકવા, જુફાઓને શિક્ષા કરવી, ચોરી કરનારાઓને પકડવા, જેની અને તેની જે અને તે વસ્તુ લૂંટનારાઓને રોકવા, એ કાર્ય, રાજ્યને જે કાયદા ઘઢી કરવું પડે છે, એ કામ દીક્ષાથી સહેજે સહજ રીતે થાય છે. છતાં આડે આવે છે એવું જે સાંભળીએ છીએ, તેનું કારણ શું છે તે આપણે વિચારવું છે.

### ગેરસમજૂતી શાથી થાય છે ?

વર્તમાનકાળમાં દુનિયાના પત્રકારો, વસ્તુસ્થિતિ સમજી સાચી જાડેરાત કરનારા હોય છે, એમ મનાયું છે; પણ જ્યારે એ જ પત્રકારો તંત્રીસ્થાનેથી સાચી વસ્તુના સ્વરૂપને ઉલટાવીને પણ વગર વિચાર્યે અને વગર તપાસ્યે આર્ટિકલો પ્રગટ કર્યે જાય, ત્યારે લોકો ઉન્માર્ગ જાય એમાં નવાઈ નથી.

પત્રકારોને માથે મોટી જોખમદારી હોય છે. પોતાના પત્રમાં પારકે નામે પણ એક વાત પ્રગટ કરવી હોય, તો પણ તપાસ કરવી જરૂરી છે, તો પછી પોતાના હાથે, પોતાની જાતે અને પોતાના નામે એક વસ્તુ પ્રગટ કરવી હોય, ત્યારે કેટલી તપાસ કરવી જોઈએ ? છતાં નથી થતી, અને લખ્યે જવાય છે, એને અંગે જ ગેરસમજૂતીઓ ઊભી થતી જાય છે.

### પહેલી ગેરસમજ :

૧. 'દીક્ષાથી અનેક અનર્થો થાય છે. બાળકોના હિતનો સંહાર થાય છે.'

એવી એવી વાતો પત્રોના તંત્રીસ્થાનોથી પણ પ્રગટ થાય છે, એ આશ્વર્યની વાત છે. જૈનદીક્ષા, એવી પરમપવિત્ર ચીજ છે કે જેની સામે કોઈથી પણ ટીકા થઈ શકે તેમ નથી. આથી એની સામે કાયદાની આવશ્યકતા નથી. જૈનદીક્ષા, ચાહે નાનો હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય,

કોઈને પણ અનર્થ કરનારી નથી. દીક્ષિત થયેલો તેનાથી બનશે તો ઉપકાર જ કરવાનો છે અને તે નહિ બને તો પોતાનું તો તે સુધારવાનો જ છે.

જૈનદીક્ષા લેનાર, સંબંધીઓની સાથેના સ્વાર્થમય સંબંધો તોડી, લક્ષ્મી અને ઘરબારનો પરિત્યાગ કરી, કેવળજ્ઞાનીઓની આશા મુજબ નિર્દોષ જીવન જીવવા જાય છે. એ રીતે સન્માર્ગે જનારા બનશે તો બીજને એ માર્ગ ચાલવશે અને તે નહિ બને તો પોતાનું તો તેઓ જરૂર જ સુધારશે, એવો ઉત્તમ કોટિનો એ માર્ગ છે.

## શાની સ્વતંત્રતા ?

વહોદરા રાજ્યના વહોદરા તળમાંથી નીકળનારું અને રાજ્ય તથા પ્રજામાં સારું મોભાદાર ગણાતું હોય, એવું એક પત્ર જૈનદીક્ષા માટે જેમ-તેમ લખી દે, એથી અનર્થ થવા સંભવ છે. જૈનદીક્ષાથી ભયંકર અનર્થો થઈ ગયા હોય એવો એ પત્ર તરફથી દેખાવ કરાય છે, પરંતુ એ દેખાવ સત્યથી કેટલો વેગળો છે, એ આપણે બતાવવું છે. એ પછી જૈનસમાજમાંથી નીકળતાં પત્રો પણ દીક્ષા માટે કેટલાં આડંબરી અને અસત્ય લખાણો પ્રગટ કરે છે, તે આપણે કમસર જોઈશું. જો બુદ્ધિપૂર્વક, વિચારપૂર્વક, થોડી પણ તપાસ કરવાની દરકારપૂર્વક જૈનદીક્ષાનું સ્વરૂપ જાળવા પ્રયત્ન કરવામાં આવશે, તો સત્યના અથીને તો એની આડે આવવાનો વિચાર જરખો પણ નહિ આવે.

શ્રી જૈનશાસનમાં જે દીક્ષા અપાય છે, એની વય નક્કી કરવાની નથી પણ શાસ્ત્રે નિયત કરેલી જ છે. આઠ વર્ષથી માંડી અતિશય વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધી, જૈન શાસ્ત્રકારોએ દીક્ષાની યોગ્યતા માની છે, રાજ્યે પણ સાત વર્ષના બાળકને બુદ્ધિપૂર્વક ગુનો કરનાર માની, એને યોગ્ય શાસન આપવાનો કાયદો કર્યો છે. જૈન શાસ્ત્રે આઠ વર્ષના બાળકને બુદ્ધિપૂર્વકના લેનારા માની દીક્ષા લેવાની છૂટ આપી છે. શાસ્ત્રે જેને સગીર વયના ગણ્યા છે, તેનાં માતા-પિતા કે વાતીની અનુમતિ વિના તેને દીક્ષા આપવાની ના પાડી છે અને તે પછી સગીર વય પૂર્ણ થયા બાદ ખોટું કામ કરવા સ્વતંત્ર નહિ, પરંતુ સારુ કામ કરવા માટે તે આત્મા સ્વતંત્ર છે એમ શાસ્ત્રે કહ્યું છે.

ગમે એટલી મોટી ઉંમર પછી પણ પાપ કરવાની જૈન શાસ્ત્રે છૂટ આપી નથી, ત્યાં તો વડીલોની આજ્ઞા અને શિખામણ માનવાનું કહ્યું છે, પણ જે આત્મા ઉત્તમ કાર્ય માટે જવા ઈચ્છા હોય, તે વડીલોની અનુમતિ મેળવવા પ્રયત્ન કરે. મળે તો અનુમતિપૂર્વક અને ન મળે તો તે વિના પણ જાય; પરંતુ અત્યારે એક જ વસ્તુ હાથ ધરવામાં આવી છે અને તે એ કે સગીર અને એની અટકાયત. એનાં મા-બાપ અને વાલી ખુશીથી રજી આપે, તો પણ તેને દીક્ષા આપવી નહિ. એ વિચારના માણસોને આધીન થયેલા પત્રકારો એક જ વાત લખી રહ્યા છે કે ‘આજે સગીરની દીક્ષાથી ભયંકર અનથો થઈ રહ્યા છે.’

### આક્ષેપો જુદ્ધા છે !

વડોદરાથી તા. ૨૦ ઓંગસ્ટ : ૧૯૭૧ના પ્રગટ થયેલા ‘સંસાર વિજય’ પત્રમાં આ વિષયમાં તંત્રીસ્થાનેથી એક લેખ લખાયો છે, તેના પહેલા જ ફકરામાં એમ લખ્યું છે કે –

૨. ‘ગુજરાતમાં તેમજ આ રાજ્યમાં છેલ્લાં આઠ વર્ષથી એવા ઘણા દાખલાઓ બનતા સંભળાય છે કે જેથી સારાં કુટુંબનાંનસગીર બાળકોની કાચી અને અજ્ઞાન બુદ્ધિનો ગેરલ્યુબ લઈ, કેટલાક ધર્મગુરુઓ એ બાળકોને પટાવી, ફીસલાવી અને છેવટે ભગાડી મા-બાપ અને વાલીઓથી છાની રીતે સંસારત્યાગની દીક્ષા આપી ચેલા મુંડે છે યા સાધુ બનાવી દે છે.’

આઠ-દશ વર્ષથી ઘણા દાખલાઓ બન્યા છે, એમ લખે છે અને આજા અગ્રલેખમાં એક જ દાખલો ટાંકે છે, અને એમાં પણ જે લખ્યું છે, એથી એ પુરવાર થઈ શકતું નથી કે પટાવી, ભગાડી, નસાડી, ફીસલાવી દીક્ષા દઈ દીધી છે. આવા ભાવવાળું આ લખાણ પહેલી જ વાર નથી, પણ પૂર્વે પણ થઈ ગયું છે.

જ્યારે વારંવાર થવા માંડ્યું, તો આપણે જાહેર કરું જ જોઈએ કે જે લખો છો તે પુરવાર કરો ! કેમ કે આ નાનોસૂનો આક્ષેપ નથી. આવા આક્ષેપ પુરવાર થયા હોય તો સાધુઓને સજા થયેલી જ હોય. પણ એવો એક પણ બનાવ બન્યો નથી, એ ઉપરથી સિદ્ધ જ છે કે સાધુઓ ઉપરના તે આક્ષેપો તદ્દન ખોટા છે. કોની ઉપર કઈ જતના આક્ષેપ થાય છે એ સમજ શકાય એવી વાત છે.

આ આક્ષેપ વ્યક્તિગત નથી, પણ દરેકેદરેક ધર્મગુરુઓ સામે આ આક્ષેપ થઈ જાય છે. આ નભાવી લેવામાં આવે, તો બધા જ સાધુઓ વુંટરાની કોટિમાં જાય અને તો સાધુઓ માટે ઉપકાર કરવાનું ક્ષેત્ર બંધ થઈ જશે, કેમ કે એવા સાધુઓનો ઉપદેશ કેમ સંભળાય? અને એવાનો ઉપદેશ સંભળવાથી ફાયદો પણ શું? આ ભયંકર કોટિનો આક્ષેપ, એકેએક ધર્મના નાયકોને માથે ભયંકર જોખમ મૂકી દે છે. વડોદરા રાજ્યમાં પ્રમાણિક ગણાતા પત્રકાર જેવા એક જોખમદાર સ્થાનેથી આ લખાય છે, એટલે આનો આપણો આજે વિરોધ કરવો પડે છે.

## પુરવાર કરો!

પહેલી વાત એ નક્કી કરવી જોઈએ કે જૈનસમાજમાં છેલ્લાં આઠ-દશ વર્ષમાં સદ્ગુરુઓના હસ્તે બાળદીક્ષિત સાધુ થયા કેટલા? વધારેમાં વધારે શોધીએ તો સગીર વયમાંથી સદ્ગુરુના હસ્તે દીક્ષિત થયેલાનો છેલ્લામાં છેલ્લો અંક મારા સ્મરણ મુજબ પચીસથી વધુ તો નહિ જ નીકળી શકે. એમાંના જેટલા દીક્ષિત થયા છે, તે બધા એમના વાલીઓની આજ્ઞાપૂર્વકના છે. એક પણ આજ્ઞા વિનાનો નથી. આટલા પણ આઠથી દશ વર્ષમાં આંતરે આંતરે બને છે. એની સામે જે લખાય છે કે ‘ધણા’ બને છે તો-‘ધણા’-એમ ક્યારે દેખાય? રોજના રોજ બનતા હોય અગર ધાડોની ધાડો પડતી હોય, ત્યારે; પરંતુ એવો ખોટો દેખાવ કરવામાં આવે અને અંની સામે કાંઈ કહેવામાં ન આવે, તો ખુદ રાજ્યમાં પણ શી અસર થાય? જો એમ ધણા દાખલાઓ બનતા હોય, તો વડોદરા રાજ્યની કોર્ટમાં એવા કેટલા કેસ હોત?

અને વળી ‘સારાં કુટુંબનાં’ લખે છે, તો એ કુટુંબના માણસો એવી રીતે દીક્ષા આપી દેનારને છોડે? આપણો પૂછીએ છીએ કે કોર્ટમાં એવા કેટલા કેસ આવ્યા અને કેટલા સાધુઓને સજી થઈ? આમાંનું કશું જ નહિ બનવા છતાં પણ એમ લખવામાં આવે છે, તો એમ કહેનું જ પડશે કે રાજ્ય અને એના અમલદાર વગની ગેરસમજૂતીમાં મૂકવા માટે ઈરાદાપૂર્વક જ આવું પ્રચારકાર્ય થાય છે. એ ન થાય એ માટે ‘સયાજીવિજ્ય’ પત્રના અધિપતિને આપણો પૂછીએ છીએ કે ગુજરાતમાં તેમજ વડોદરા રાજ્યમાં ધણા દાખલાઓ બન્યાનું કહો છો, તો કેટલા

બન્યા અને કયા કયા સારા કુળના છોકરાને નસાડી, ભગાડી અને ફોસલાવીને દીક્ષા આપી ?

કંઈ તો આ વાતને પુરવાર કરી આપો કે સંગીર વયનાં બાળકોને પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી, મા-બાપ અને વાલીઓથી છાની રીતે દીક્ષાઓ આપવામાં આવી હોય; અને એ પુરવાર ન કરી શકો તો અમે ભારપૂર્વક કહીએ છીએ કે આ એક જાતની ધર્મગુરુઓની ભયંકર બદનક્ષી છે. ધર્મગુરુઓને ભયંકર તરીકે ચીતરવાનો આ આક્ષેપ અમુક ઉપર નથી જતો પણ સર્વ ઉપર જાય છે અને આનો જવાબ દેવાનો સહુનો અધિકાર છે. તેમજ આનો વાજબી ઉત્તર ન આપી શકો, તો તમારો પત્રકાર તરીકેનો ધર્મ તમે ભૂલીને દુનિયાને ઉન્માર્ગ લઈ જનાર ઠરો છો.

ત્યાર પછી એ જ લેખમાં ‘બાળકોને વૈરાગ્ય કેમ થાય ?’-એમ કહીને તે વાતને ઘૃણાજનક રીતે હસી. કાઢવામાં આવે છે; પરંતુ એનો રદિયો આપણો હમણાં નહિ આપતાં અવસર આવ્યે પ્રમાણપુરસ્કર બતાવીશું. હાલ તો આપણો બીજા કેવા બનાવટી આરોપો ઉપજાવી કાઢવામાં આવે છે તે જ જોઈશું. આગળ ચાલતાં એ જ પત્રકાર લખે છે કે –

૩. ‘ધર્મના ઓછા નીચે એ સંન્યાસ દીક્ષાનો બહોળો પ્રચાર વધવાથી ખુદ સંગીરનાં વાલીઓ અને ધર્મગુરુઓ વચ્ચે ખુલ્લા ઝઘડા-મારામારી થઈ, પોલીસ અને ન્યાયની અદાલતોએ કેસ ચઢવા માંયા. એટલી હદ સુધી જ્યારે એ બદીએ આગળ વધી ગંભીર અને અનિષ્ટ રૂપ લીધું, ત્યારે પોકાર વધતાં સંગીરના રક્ષણની ખાતર સરકાર વચ્ચે પડી. કાયદો કરવાની આવશ્યકતા ઘણાને જરૂરી હતી અને તેથી ચોમેરથી માગણીઓ થઈ હતી.’

આમાં ધર્મગુરુઓ અને સંગીરના વાલીઓ વચ્ચે ખુલ્લા ઝઘડા અને મારામારી થઈ. અને કેસો થયા, એવું જે લખવામાં આવ્યું છે, તો એવા દાખલાઓ બન્યા હોય તો એ લખનારે પુરવાર કરી આપવું જોઈએ. વળી બદી એટલે ચેપી રોગ તરીકે દીક્ષાને સંબોધવામાં આવે છે.

એણે ગંભીર રૂપ લીધું હતું એટલે પોકાર વધી ગયો અને સરકારને વચ્ચે પડવાની ચોમેરથી માગણીઓ થઈ, એમ પણ કહેવામાં આવે છે.

ચોમેરની માગણીમાં એક 'મહાસુખભાઈ' ! બીજા નંબરે હોય તો અમુક ગામના 'ધૂવક સંઘ' ! ત્રીજા નંબરે હોય તો જૈનસમાજનું નામચીન 'જૈન' છાપું ! અને બીજા કોઈ હોય તો તે પણ કોઈક જ ! એ ચોમેરની માગણી.

પણ આ બધાએ જાહેરમાં એવી માગણી કરી હોય એવું સ્વચ્છ તો બહાર આવ્યું હોય, તેમ સ્મરણમાં નથી. છતાં ચોમેર માગણી, ભ્યંકર બદ્ધી, કેસો અને મારામારી, એ શબ્દો લખવા પડ્યા છે, કારણ કે એ ન લખે તો પહેલો ફક્રો કિંમતહીન થઈ જાય છે. એટલે જેવી ઈમારત બાંધવી હોય એવો પાયો ચણવો જ જોઈએ.

એક પાદ્ધિક તરફથી માગણી થઈ એમ લાખ્યું હોત તો હજુ માની લેત, પણ ચોમેરથી માગણી થઈ એટલે સર્વપક્ષીય માગણી જેવો અર્થ થાય છે. બદ્ધી, કેસ, મારામારી, -આ બધા એટલા ભ્યંકર કોટિના આક્ષેપો છે કે એને પુરવાર કરવા બનતી તક આપવી જોઈએ અને જો આવું જ બનતું હોય ને પુરવાર કરી દે, તો આપણે પણ કહીએ છીએ કે એ કાયદો થાઓ ! કેમ કે આ તો લૂટાલ કામ થયું. એ આરોપો પુરવાર થઈ જાય તો કાયદા સામે બિલકુલ વિરોધ છે જ નહિ. માટે આપણે એમને કહીએ છીએ કે કાયદો કરાવવાની હોંશ હોય તો આ વસ્તુ પુરવાર કરો !

## સગીરનું હિત બગડે છે ?

બીજુ દલીલ આપે છે કે -

૪. 'સગીરના હિતની ખાતર આ કાયદાની આવશ્યકતા છે.'

આપણે પૂછીએ છીએ કે આ માર્ગો વાલીએ સગીરને ચડાવતા હોય, તો એમાં સગીરનું અહિત શું થાય છે ? આ જ રાજ્યમાં ફરજિયાત કેળવણીનો કાયદો થયો છે કે જે મા-બાપ પોતાના દીકરાને કેળવણી ન આપે એને દંડ કરવો.

મા-બાપ કે બાળકની ઈચ્છા હોય કે ન હોય, છતાં ફરજિયાત કેળવણીનો કાયદો કરનાર રાજ્ય, ફરજિયાત નહિ પણ મરજિયાત, બાળકની ઈચ્છા કરાવીને, ચોગ્ય મા-બાપ સન્માર્ગો ચડાવવાનો પ્રબંધ કરે, તો એમાં પ્રતિબંધ શું કામ કરે ? દીક્ષા જેવી ચીજ ફરજિયાત લેવી જોઈએ, એવું તો કોઈ કહેતું નથી. પૂર્વના શુભ સંસ્કારો જાગે, કર્મોનો

કષોપશમ અગર લઘુકર્માપણું થવાથી જે બાળકને ઈચ્છા થાય અને મા-બાપ અને સન્માર્ગે ચડાવવા તૈયાર થાય, તો પછી વિરોધ શો ?

આ કાયદાનો અર્થ તો એ થાય કે ‘સુસંસ્કાર પારી બાત્યકાળથી સારા માર્ગે ચડાવનાર યોગ્ય વાલીઓના હક્ક ખૂંચવી લેવા.’ એ કઈ રીતે યોગ્ય છે ? જે વાલીઓ પોતાના દીકરાઓને એવું શિક્ષણ આપે છે કે જેના પરિણામે એ એવા નીવડે કે જેઓ જેલમાં સબડે છે અગર રાજ્યને અને પ્રજાને ભયંકર જોખમરૂપ બને છે, જેઓ દંડ આપીને પણ બાળકને શિક્ષણ નથી આપતા, પોતાનાં બાળકોને દુનિયામાં પોતપોતાના ધંધા, રિવાજ અને કુટેવો શીખવે છે, મહિરાપાન કરનારાઓ, લૂંટારાઓ, ચોરો, અનીતિ અને અન્યાયખોરો, પોતપોતાના દીકરાઓને તે તે વ્યસનો શીખવી રહ્યા છે, અનું વાલીપણું ખૂંચવી લેવા માટે રાજ્ય તરફથી કાયદા કરવામાં આવ્યા છે કે ?

કાયદા તો ખરા તે થવા જોઈએ કે જેટલાં અધમ અને દુરાચારી કુળ હોય, એટલાનાં બાળક જન્મે ત્યારથી એનું વાલીપણું ખૂંચવી લેવું જોઈએ. પણ એવાઓનું વાલીપણું તો અખંડિત રહે ! એવાને તો ગુનો કરે, પકડાય અને પુરવાર થાય તો સજી અને દીક્ષા આપે એ મા-બાપને તો સીધી જ સજી ! બાર માસ અથવા એક હજાર રૂપિયા દંડ, અગર તે બને ! આવા એક કાયદાની આ પત્રકારે તરફદારી કરી છે, ‘થવો જોઈએ, એમ એ પત્રકાર કહે છે અને એમ થવું બહુ જરૂરી છે, એમ બધાને એ સમજાવે છે !

## હવે આવો સગીરના હિતની વાત ઉપર :

સગીર પાછો આવે તો શું થાય ? હું એમ કહું છું કે મોરી ઉંમરનો દીક્ષિત થયેલો ન પણે ને પાછો આવે તો શું થાય ? બીજી વાત એ કે સગીર ધેર ચાલી આવ્યો અને તેને વારસો ન મળ્યો, એવો એક પણ કેસ કોર્ટમાં નથી. એવો એક પણ બનાવ નથી. સગીર ઉંમરના દીક્ષા લીધા પછી પડી ગયાનાં દિશાંત પ્રાય: શોધ્યાં પણ જુદે એમ નથી.

હજુ ઉંમરલાયક પતિત થઈને ધેર આવ્યાનાં દિશાંતો છે, પણ સગીરનાં દિશાંતો મોટે ભાગે નથી. છતાં વર્ષોભરમાં એકાદ દાખલો બની જાય, એ કંઈ દિશાંતરૂપ લેવાય નહિ. અને એવા માટે તો જે બાળકો

ખરાબ થઈ ગયાં અને એનાં માનભાપોએ રખડતાં મૂકી દીધાં, એના માટે રાજ્યે કાયદા કર્યા છે ? માટે સગીરના હિતને અંગે જેટલી વાતો કહેવામાં આવે છે, એ બધી ખોટી ને બનાવવી છે.

## કાયદાની જરૂર છે ?

આગળ જતાં લખે છે કે

પ. 'બ્રિટિશ ગુજરાતમાં પરદેશી અને વિધમાં રાજ્યસત્તા હોવાથી આવી બાબતમાં પગલાં લેતાં અચકાય રેથી તેવા કાયદા માટે આશા થોડી રહે છે, પરંતુ પ્રજાની સામાજિક, ધાર્મિક અને નૈતિક સ્થિતિ સુધારવા માટે આપણા શ્રી મહારાજા સાહેબ એક સ્વદેશી રાજકર્તા તરીકે પોતાની પ્રજા પ્રત્યેનો પવિત્ર ધર્મ સમજતા હોઈ, આવી બાબતમાં સ્વાભાવિક રીતે જ આપણા રાજ્યે તેવો કાયદાનો મુસદ્દો ધરીને પ્રજાની સૂચનાઓ માટે આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કર્યો છે.'

આની સામે આપણે એમ કહીએ છીએ કે જે દિવસે રાજ્ય અને પ્રજાનો પવિત્ર ધર્મ શું છે, પ્રજાનું સામાજિક, ધાર્મિક અને નૈતિક હિત શી રીતે થઈ શકે, એ વાત રાજ અને રાજ્યાધિકારીઓ યોગ્ય ધર્મગુરુઓ પાસે સંભળશે, તે દિવસે રાજ્યસત્તા સારી રીતે સમજી શકશે કે આવા એક કાયદાથી પ્રજાનું કોઈ પણ હિત સચ્ચવાતું નથી, પણ ઉલદું વાસ્તવિક હિતનું ખૂન થાય છે.

જેઓ યોગ્ય આત્માઓને ધર્મમાર્ગે ચાલવનારા હોય, તેઓને આ વસ્તુ પુરવાર કરી આપવી એ કાંઈ જ કઠણ નથી. ધર્મના પ્રમાણિક નેતાઓને પૂરેપૂરી રીતે સંભળાય, તો આવા કાયદાથી પ્રજાનું હિત કોઈ પણ રીતે સાચવી શકતું નથી, એટલું જ નહિ પણ પ્રજાહિતનું ઉલદું ખૂન થઈ જાય છે, એ વાત સમજવી સહેલ છે.

## વડોદરાનો કેસ :

હવે ઘણા દાખલાઓની વાતમાંથી ફક્ત એક જ દાખલો મળી આવે છે અને તેને આ અગ્રલોખમાં જેટલી થાય તેટલી ટીકાટિપ્પણપૂર્વક ટંકવામાં આવે. છે. ડલ્ભોઈનો છોકરો, છાણીમાં દીક્ષા અને વડોદરામાં કેસ એ કેસને અંગે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કહીએ છીએ.

એ કેસ બન્યો તે એના વાલીઓની હૃદયપૂર્વકની ઈચ્છાથી નથી બન્યો. એ કેસ બન્યા પછી છોકરાએ કોર્ટમાં ખુલ્લેખુલ્લું સૂચવ્યું કે ભેં મારી રાજ્યભૂશિથી દીક્ષા લીધી છે અને સંધુઓએ મને દીક્ષા લેવા કાઈ પણ દબાણ કર્યું નથી.'

દીક્ષા લીધાના છ-બાર મહિના પહેલાંથી એ છોકરો ઉત્તમ પ્રકારનું જીવન જીવતો હતો. કુંભીઓને માલૂમ હતું કે આ દીક્ષા લેવાનો છે. તે છતાં પણ 'પારકું શીખવેલું બોલે છે,- એમ કહીને કોર્ટ એને ઘેર પાછો મોકલાવ્યો હતો. ઘેર પાછો ગયા પછી થોડો જ વખત ઘરમાં રહ્યા બાદ, વાલીઓની સમ્મતિપૂર્વક એ છોકરાએ ફરી દીક્ષા લીધી છે અને અત્યારે દીક્ષિત અવસ્થામાં મોજૂદ છે.

આ દાખલા ઉપરથી નસાડવા, ભગાડવા, ફોસલાવવા, પટાવવાનો એક પણ આરોપ વાસ્તવિક રીતે પુરવાર થઈ શકે એમ નથી. છતાં આના ઉપર તો એ લેખમાં ઘણું લખી નાખ્યું છે અને કહે છે કે-

'આ બાબતમાં સર્ગીર બાળકોને રક્ષણ આપવા ખાસ કાયદો નહિ હોવાથી, ઘણા ધર્મગુરુઓ સામાન્ય ફોજદારી કે બીજી કાયદાઓની છટકબારીઓનો લાભ લઈ, સર્ગીરોને ઉઠાવી, નસાડી, સાધુ બનાવી દેતા અને વૃદ્ધ મા-બાપોને રડાવી તેમની જિંદગી દુઃખી કરતા હતા.'

આપણે એમ પૂછીએ છીએ કે શું રાજ્ય પાસે આવી રીતે ઉપાડી લઈ જનારનું રક્ષણ કરવા માટે કાયદાનું સાધન નથી? એ સાધન ન હોય તો ચોછાઓ નહિ ઉપાડી જય? સર્ગીરોના રક્ષણ માટે રાજ્ય પાસે જોઈએ એટલાં સાધન છે, છતાં 'નથી' એમ માની લઈએ, તો પણ ઉઠાવી જવાનો આરોપ પુરવાર ન કરે, ત્યાં સુધી આ કાયદાની આવશ્યકતા કોઈ રીતે ઠરી શકતી નથી.

## નવયુગ શું માગે છે ?

અત્યાર સુધી કાયદાની આવશ્યકતા સમજાવી લોકોને તેમાં સહકાર આપવાની વાત કરી. હવે એ પત્રકાર એક નવી જ વાત લખે છે-

૬. 'આ નિબંધ સંબંધમાં કેટલાક તરફથી કંઈક ગેરસમજૂટી ફેલાવવાનો અને કાયદાને અમલમાં નહિ આવવા દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ

મનોદશા હલના વિચારસ્વાતંત્ર્ય અને પ્રગતિના નવયુગમાં ખરેખર દિલગીરી ઉપજાવે તેવી છે.'

આ યુગ, સ્વાતંત્ર્ય અને પ્રગતિનો છે, તો એવા યુગમાં આ મુસદ્ધ સામે વિરોધ થાય, એમાં દિલગીર થવા જેવું શું છે? એનો વિરોધ, એ સ્વાતંત્ર્ય અને પ્રગતિને ટેકો આપે છે કે અટકાવે છે? પણ જ્યાં એક જ ધૂન હોય કે યુગધર્મને પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, પણ ગમે તે ભોગે આ કાયદો પસાર થવો જ જોઈએ, ત્યાં ગમે તે શબ્દોના ઓઠા નીચે આ કાયદો યોગ્ય છે, એટલું જ પુરવાર કરવાનું રહે છે.

જો આ યુગને સ્વાતંત્ર્ય અને પ્રગતિનો માનતા હોઈએ, તો આ કાળમાં તો ઊલટા એવા કાયદા થવા જોઈએ કે સારા માર્ગે વાલીઓએ પોતાનાં બાળકોને ચડાવવાં જ જોઈએ અને ન ચડાવે તો રાજ્ય ખબર લેશે.

આજે તે બાળકો પણ એ જ માર્ગ છે કે અમે અમારી ઈચ્છા મુજબ કેમ ફરીએ, હરીએ કે કરીએ નહિ? જે યુગમાં હજારો બાળકો, રાજ્ય સામે જે રીતે પ્રજામાં બેટિલી ઉપજાવે એવાં ગાયનો ગાવાની ધૂટ લેનારાં છે, એ જ યુગમાં આત્મકલ્યાણના માર્ગ જવાની ઈચ્છા થાય એ બાળક અને એના વાલીના હદ્યની સ્વતંત્રતા ઉપર તરાપ મારવી છે, તો આપણે પૂછતું પડશે કે 'એ સ્વતંત્રતા મોઢે બોલવાની છે કે હદ્યથી માનવાની પણ છે?' માટે નવયુગને પણ જો બરાબર રીતે સમજવામાં આવે, તો આ કાયદાની આવશ્યકતા નકારી ઠરે છે.

પણ દુઃખની વાત તો એ છે કે આ માર્ગ કરડો છે. દરેકેદરેક બાળકને આ માર્ગ પર રસ નથી થતો. પૂર્વ ધર્મની આરાધના ખૂબ ખૂબ કરી હોય અથવા લઘુકમ્ભી હોય એવાં બાળકોને જ આ માર્ગ પ્રત્યે પ્રેમ થાય છે. આ સંયમમાર્ગ કાંઈ સહેલો નથી. હરેક આત્માને એના પર પ્રેમ નથી થતો. મોટા મોટા બુઝ્હાઓ પણ આ માર્ગની વાત સંભળતાં મોઢું કટાણું કરી દે છે.

પૂર્વના સુસંસ્કાર હોય તેને જ એના પ્રત્યે પ્રેમ થાય છે અને એ રીતે જેને પૂર્વના શુભ સંસ્કારોના યોગે એ ઠીક લાગે, તેની સામે આડ કરવા કટિબદ્ધ થનારને એવો પ્રતિબંધ ન કરવાને સમજાવવા કોઈ પ્રયત્ન કરતું

હોય, તો તે પણ વાજબી નથી તેમ કહેવું, એ કેટલું બધું બેહૂદું અને સ્વાતંત્ર્ય તથા પ્રગતિનું રોધક છે, એ ખાસ વિચારણીય છે.

## કાયદાનો વિરોધ શા માટે ?

હવે એ પત્રકાર એવો કાયદો ન થાય, એવી પેરવી કરનારાઓને ઉદ્દેશીની લખે છે કે –

૭. ‘આ કાયદો સર્વ ધર્મ અને સંપ્રદાયો માટે લાગુ થઈ શકે, તેવો સર્વસાધારણ સ્વરૂપનો હોવા છતાં માત્ર જૈન કોમના એક ભાગમાં આધી ભાગવતી દીક્ષા અને ધર્મગુરુઓના હક્ક ઉપર રાજ્યનું આકમણ થાય છે, એવી ગેરસમજથી આ કાયદો નહિ થાય તેવી હિલચાલ શરૂ થઈ છે અને અમદાવાદમાં તો તે માટે એક સમિતિ પણ નિમાંદ્ધ છે. અમે ઈચ્છાએ છીએ કે સમજુ અને શાષ્ટ્ર જૈન કોમના નેતાઓ-શ્રાવકો તેમજ ધર્મગુરુઓ આ બાબતમાં ધાર્મિક લાગડી કે હક્કનો સવાલ ઊભો કરવાની ગેરસમજ નહી કરતાં-સગીર બાળકોના રક્ષણની પવિત્ર ફરજનો ધર્મ, નીતિ, વ્યવહાર તેમજ કાયદાની ટાણિએ ગંભીરપણે વિચાર કરશે.’

આપણે કહીએ છીએ કે ગંભીરપણે વિચાર કરીને જ પ્રયત્ન આરંભાયો છે. કોઈ પણ આગેવાન જરા પણ ગેરસમજથી દોરવાયેલ નથી, કેમ કે આ કાયદાથી ધર્મગુરુ, વાલી અને સગીર, બધાનાં હિત ઉપર આકમણ થાય છે. આ કાયદો ન હોય તો જ સગીર બાળકનું હિત જળવાઈ શકે તેમ છે અને એથી જ એનો વિરોધ વાજબી છે અને તેના માટે ઉઘમ થાય છે અને કરીશું, એવી જહેરાત કરીએ છીએ.

## સગીરોનું રક્ષણ ક્ર્યાં હોય ?

હવે એ પત્રકાર છેલ્લે છેલ્લે કાયદાનું આખું સ્વાત્મકરણ કરે છે કે

૮. ‘આ પ્રતિબંધથી કોઈ પણ સગીર બાળકોને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની દીક્ષા આપી, કાચી અણસમજુ વયે તેને સંસારત્યાગ કરાવવામાં ન આવે અને ધર્મ કે કાયદા વિરુદ્ધના તેવા કાયમાં કોઈ મા-બાપ, વાલીઓ કે અન્ય કોઈ સાચી શ્રદ્ધા કે ખોટા સ્વાર્થથી સંમિતિ યા મદદગારી ન આપી શકે તે હેતુ છે. સગીરના ભાવિ હિત અને હક્કનું રક્ષણ કરવું તે મા-બાપોની જ નહિ પણ કોમ, સમાજ અને તેથી આગળ વધી છેવટે સરકારની પણ ફરજ છે. અને તે ફરજ બજાવવા મા-બાપો અને સમાજનેતાઓ નિષ્ફળ જવાથી, લોકોની માગણીઓથી રાજ્યને આવો કાયદો કરવાની જરૂર જણાય છે. તેમાં

કોઈનાં ધર્મનીતિ કે સામાજિક હક્કો ઉપર ત્રાપ મારવાનો કે આકમણ કરવાનો સરકારનો હેતુ નથી-હોઈ શકે નહિએ. આમાં માત્ર સગીરોનું રક્ષણ એ એક જ હેતુ છે અને તેમ કરવું તે રાજ્યની પવિત્ર ફરજ છે.'

અમે એની સામે એમ કહીએ છીએ કે 'તમે બાળક અહિત થાય એવા માર્ગો ચરી જાય, ખરાબ ચાલે ચરી જાય, એનાથી એનું રક્ષણ કરવું-આવું જો સાચા દિલથી જ માનતા હો, તો રાજ્ય પાસે એવી અરજી ગુજરાતો કે 'ભયંકર પાપાચરણમાં ઉછેરી રહેલા વાલીઓ પાસેથી વાલીપણું પડાવી લો.' પણ એ નથી થતું અને આ થાય છે, એથી એક જ વાત સિદ્ધ છે કે સમાજમાં અનીતિ, અન્યાય કે ત્રાસ ફેલાય એની દરકાર નથી. માત્ર એક જ દરકાર છે કે કોઈ પણ બાળક દીક્ષિત ન થાય.

તમને એની જ પડી છે. આજે જેલો ભરેલી રહે છે, પોલીસને રાત-દા'તો ઉઘાડો પહેરો ભરવો પડે છે, એ છોકરા આકાશમાંથી પડેલા છે કે કોઈ પણ વાલીના હથ નીચે ઉછારેલા છે? એ વાલી ખોટા હત્તા માટે જ ને? એના વાલીઓને બધી છૂટ? દીક્ષા અપાવનાર ઉપર કે દીક્ષા વેનાર બાળક ઉપર એવી જાતનો કોઈ આરોપ નથી કે તે ભયંકર પાપ કરી રહ્યો હોય, છતાં એની સામે કાયદા કરવાનું મન થાય છે, તો અનાડી લોકો માટે કાયદા કરવાનું મન કેમ ન થયું?

જેને ખોટું શિક્ષણ આપી ખોટે માર્ગો લઈ જવાય છે, તેની સામે કાયદા કરવાની જરૂર ન જણાઈ? જેના દીકરા ચોરી કરશે, ખોટું આચરણ આચરશે, તેની સજા તેનાં મા-બાપને થશે, એવો કાયદો કરાવી શકતા હો તો કરાવો કે જેથી જગતની શાંતિમાં કાંઈક વધારો થાય.

### ધર્મગુરુઓ અને યુગધર્મ :

હવે છેલ્લે બધા ધર્મગુરુઓને સલાહ આપે છે.

૮. "ધર્મગુરુઓ પણ યુગધર્મ સમજી પોતાના અનુયાયીઓને સાચે માર્ગ દોરશે અને દરેક ધર્મનાં સાધુમંડળ અને આચાર્યો પણ આ કાયદાને ટેકો આપી સગીરોને સંન્યાસ દીક્ષા નહિ આપવાના ઠરાવો કરી, ધર્મચાર્ય તરીકે ધર્મ અને સમાજ તરફ પોતાની ફરજ બજાવશે."

ધર્મગુરુઓને યુગધર્મની સલાહ આપતાં, પોતે યુગધર્મમાં માને છે કે કેમ, તેની જ અમને શંકા થાય છે. આજનો યુગધર્મ તો કહે છે કે દરેક પોતાના વાજબી હક્કો જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે ધર્મગુરુઓ અને યોગ્ય વાલીઓના વાજબી હક્કો આ જ છે કે કુમળી વયનાં બાળકોમાં ખોટી વાસના પડે તે પહેલાં સારી જગ્યાએ મૂડી દેવાં તથા ઉત્તમ સંસ્કારોથી સંસ્કારિત થયેલાં સગીર બાળકોનો એ જ વાજબી હક્ક છે કે ઉત્તમ સ્થાનમાં સ્થાન મેળવતું કારણ કે મોટી ઉંમરે વિષયવાસનાના કુસંસ્કારોથી સંસ્કારિત થયા પછી ધર્મમાર્ગ ચાલવવા કઠિન છે અને ચક્યા પછી સાચવવા કઠિન છે. આથી ધમ્મકુટુંબમાં જન્મેલાં બાળકોને તેમનામાં કુસંસ્કારો આવે તે પહેલાં, એમના વડીલો એમને સારા માર્ગો લઈ જાય, જેથી તેઓ નીતિસંપન્ન બને, સાચા જ્ઞાની બને અને જગતના સહવાસમાં આવતાં અનેક યોગ્ય આત્માઓને શુદ્ધ નીતિસંપન્ન બનાવી શકે.

**‘સયાજ વિજય’ના તંત્રી જો યુગધર્મ શીખવતા હોય, તે તેમને કહી દેવું જોઈએ કે અમારો યુગધર્મ તમે કહો છો તેથી—એટલે એવા હિતવિરુદ્ધના કાયદાઓ કરાવવાથી—વિરુદ્ધનો છે.**

આજે કહેવાય છે કે દેશના હિતને હાનિ પહોંચે તેવી કેળવણી લેવી એ પણ પાપ છે, તો અમે પણ કહીએ છીએ કે દીક્ષાની પવિત્ર ભાવનાને હાનિ પહોંચાડે એવા સંસર્જનિમાં રહેતું, એ પણ પાપ છે, બાળકોને એવા સંસર્જનિમાં રાખવાં, એ મા-બાપને શિરે પણ પાપ છે, કારણ કે તેઓ એટલી બાળક પ્રત્યેની ફરજ ભૂલે છે. અમારો યુગધર્મ તો અત્યારે આ છે. આજની પ્રવૃત્તિ કહે છે કે ‘ઉંમર યોગ્ય થયા પછી મા-બાપને કહી દેવું કે અમારી આ ઈચ્છા છે, સમજે તો ઢીક નહિ તો છોડી દેવાં અને કુટુંબ કે ઘરની દેશહિતની આગળ ચિંતા કરવી એ પણ પાપ છે.’ એવા ઘણા દાખલાઓ બન્યા છે. એ યુગધર્મ અમારી પાસે બતાવવો હોય, તો અમે આ ઠરાવને ટેકો શી રીતે આપી શકીએ ?

યુગધર્મની સલાહ આપીને તો તમે અમને ટેકો આપવાનું નથી કહેતા, પણ એ કાયદાની સામે થવાનું કહો છો ! આજનો યુગ તો કહે છે કે ઘરની બાબતમાં રાજ્યને વચ્ચમાં ન લાવો. સમાજની બાબત

સમાજને સમજી લેવા દો અને ધર્મની બાબત ધર્મત્માઓને જ સમજી લેવા દો ! માટે યુગધર્મની વાત કોઈ પણ રીતે તમારી સલાહને બંધનેસતી નથી. આ લખાણ તમે પોતાની બુદ્ધિથી લખ્યું હોય, તો તેને પુરવાર કરવાની તમારી પવિત્ર ફરજ છે અને પુરવાર ન કરી શકતા હો તો જહેરમાં તે લખાણ પાછું ખેંચી લેવું જોઈએ. અને તેમ કરીને પત્રકાર તરીકેના તમારા ન્યાયીપણાની પ્રતીતિ તમારે કરાવવી જ જોઈએ.

‘સગીરના વાલીઓ અને ધર્મગુરુઓ વચ્ચે ખુલ્લા જ્ઘડા-મારામારી થઈ, પોલીસ અને ન્યાયની અદાલતોએ કેસો કાઢવા માંડ્યાં’ આવી આવી જે વસ્તુઓ આજ દિન સુધી બની નથી, તેને બની એમ લખવામાં આવ્યું છે અને એથી ધર્મસંપ્રદાયોના નાયકો ઉપર ભયંકર જાતનો આક્ષેપ કર્યો છે. એકેએક ધર્મસંપ્રદાયના સાચા ધર્મનિષ્ઠ આગેવાનો જરૂર એ આક્ષેપની ખબર લેવા પ્રયત્ન કરશે. કોઈ પણ સંપ્રદાય બાલબ્રહ્મચર્ય કે એવી જ જાતના યોગ્યપણાનો ઈનકાર કરતા નથી.

### ઉપસંહાર :

આ તો પર પત્રકારની વાત કરી, પણ આપણા ઘરનાં એટલે જૈન સમાજનાં પેટભરાં પત્રો તો એથી પણ આગળ વધે છે. હું જાણું છું ત્યાં સુધી આ પત્રકાર તો જૈન નથી પણ ઈતર છે, એટલે એ તો જેટલું સૂર્યાં-સાંભળ્યાં હોય તે ઉપર મદાર બાંધીને પણ લખવા પ્રેરાય અગર રાજ્ય તરફથી કાયદાનો મુસદ્દો બહાર પડ્યો, તો એના હિતનું જ લખતું, એમ માનીને પણ લખ્યું હોય, તે છતાં લખેલી વાત અસત્ય હોય તો રાજ્યને પણ ખોટી સલાહ આપનાર તરીકે પુરવાર થાય, એટલું જ નહિ પણ જે વખતે મુસદ્દો બહાર પડે છે તે વખતે ખોટી-ભળતી વાતો ન લખી શકાય. જે વખતે રાજ્યે સંઘળાઓ પાસેથી અભિપ્રાયો માંગ્યા છે, તે વખતે આ રીતે અભિપ્રાય એક પત્રકારે લખી દેવો, એ બહુ અન્યાય છે.

હજુ પણ દરેકેદરેક, પ્રમાણિક ગણાતા પત્રકારોને મારી ભલામણ છે કે પેટભરાં પેપરો જેમ ફાવે તેમ લખી નાખે છે, એની વાત બાજુ પર મૂકી છે, કારણ કે એમને તો ગમે તે રીતે પેટ ભરવું છે. એવાઓની તો

એ માન્યતા હોય છે કે જેલ નહિ મળે ત્યાં સુધી સાચું-ખોટું છાપીને પેટ ભરીશું અને સજી થઈ તો જેલમાં પેટ ભરીશું. વળી પેપરવાળો થયો એટલે એને આસાન કેદ મળે એ સામાન્ય કાયદો છે, માટે એવાની વાત જવા દો.

પરંતુ મોટા, ડાખા અને નામાંકિત પત્રકારની એ ફરજ નથી. જૈનદીક્ષા જેવા મહાન પ્રશ્ન પસ ગમે એવા તદ્દન ખોટી તથા અર્ધસત્ય હકીકતોથી ભરેલા અને રાજી તથા પ્રજાને ખોટે માર્ગ દોરનારા લેખો ન લખો ! ધર્મગુરુઓને મળો, પૂરતી તપાસ કરો અને પછી લખો ! ‘પ્રજામિત્ર’ પત્રકારે પણ દીક્ષાને મોટો દેટ્ય કહ્યો છે. અને સાધુઓને ગુંડા વગેરે તરીકે ઓળખાવ્યા છે. આમ લગ્નામ વિનાનું લખવાની પદ્ધતિ થઈ પડી છે અને એવાઓને કોઈ પૂછે કે ‘તમે શાથી આમ લખો છે ?’ તો તેના સીધા ઉત્તર પણ નહિ આપે. સાંભળશે જ નહિ. આવી રીતના પત્રકાર સમાજને શ્રાપરૂપ છે. ધર્મની બાબતમાં દુનિયાને આડે રસ્તે દોરે છે. ઈતર લોકો આથી ભાંતિમાં પડે છે. જેટલા એવા પત્રકારો દીક્ષા આદિ ધાર્મિક વિષયમાં આર્ટિકલ લખે છે, તે કોઈની શિખવણીથી, દોરવણીથી અગર પારકી સલાહોથી લખે છે, એમ કહેવું જ પડશે. કોઈ પણ જાતની પાકી બાતમી મેળવ્યા વિના મનસ્વી રીતે જેમનાં તેમ-ખોટા આક્ષેપભર્યા લખાણો કર્યા કરે છે, માટે એવાં લખાણોથી સમાજે ચેતતા રહેવું જોઈએ.

‘સયાજ વિજય’ અને ‘હિંદુસ્તાન’ વગેરે પત્રો પર આજે હું આરોપ મૂકું છું કે એ લોકો દીક્ષા સંબંધી આર્ટિકલો અને લેખો તંત્રીસ્થાનેથી લખે છે, તે પારકાની શિખામણથી, પારકાની સલાહથી, તપાસ કર્યા વિના, મનમાં આવ્યું તેમ લખે છે અને એથી જૈનદીક્ષા જેવા પવિત્ર પંથને વગોવી રહ્યા છે અને પવિત્ર જીવન જીવતા જૈન સાધુઓને નિંદી રહ્યા છે.

આ વાત આપણે એટલા જ માટે જહેર કરીએ છીએ કે વડોદરા રાજ્યના ન્યાયી અધિકારીઓ ઉપર એવા લેખોથી ખોટી અસર થાય નહિ. દીક્ષાને દેટ્ય કહેવો અગર બદ્દી કહેવી, એ બધા આક્ષેપ બનાવટી, સત્યથી વેગળા અને સાબિત ન થઈ શકે તેવા છે. જે

તેઓમાં પોતાની વાત પુરવાર કરી આપવાની હામ હોય, તો ખુશીથી પુરવાર કરી આપે.

અપવાદ દરેક જગ્યાએ હોય છે. દીક્ષિત થનારમાં એકાદ-બે ટકા એવા પણ નીકળી જાય, પણ સગીરોને ઉઠાવી, પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી અનુમતિ વિના મુંડી લેવામાં આવે છે, એ વાત તદ્દન જુફી, બનાવતી અને દીક્ષાને નિંદવાના દુષ્ટ ઈરાદે ઉપજાવી કાઢવામાં આવી છે.

બીજી વાત એ છે કે જૈનદીક્ષા જેવા પવિત્ર માર્ગમાં દીક્ષિત થયા પછી બાળક કે મોટા કોઈ ઉપર જુલમ ગુજરાતો જ નથી. ધર્મ એ શક્તિ મુજબ કરવાનો છે, ઈચ્છાથી કરવાનો છે. એના માટે બળજબરી છે નહિ અને વપરાતી પણ નથી.

સગીર વયમાંથી પતિત થનારા કોઈ અપવાદ સિવાય નીકળી શકે એમ નથી. મોટી ઉમરમાંથી પડવાનો સંભવ વધુ છે અને પડે પણ છે. પરંતુ જેટલો ઘોંઘાટ થાય છે તેવા તો નહિ જ. એમ તો શાહુકાર બજરોમાંથી પણ બારે મહિને બે-પાંચ દેવાળું કાઢનાર નીકળે છે, તેથી કાંઈ બજરો બંધ થઈ જતા નથી.

આવી વાતોને આગળ કરીને ધર્મ લોકોના વાજબી હક્કો પર તરાપ મારવી, તે ભયંકર પાપાચરણ છે:

\* \* \*

## બાળદીક્ષા અંગે પ્રશ્નોત્તરી

કુલોજિથી યાત્રાએ પ્રવચન દશમામંથી

આણ-મીરજવાડી

માધ્યમિક કૃષ્ણા- ૬ વિસ્. ૧૯૮૪ તા. ૨૦-૨-૧૯૮૮,  
રવિવારે બપોરના ત્રણ વાગ્યાથી જ વ્યાખ્યાનનો કાર્યક્રમ  
રાખવામાં આવ્યો હતો. આણા, સાંગલી અને કરાડ  
વગેરે સ્થળોએથી મોટો જનસમુદ્દાય આવી પહોંચ્યો  
હતો. આજના વ્યાખ્યાનમાં દિગંબરોની હાજરી મોટા  
પ્રમાણમાં હતી, જેમાં દક્ષિણ-મહારાષ્ટ્રના દિગંબર નેતા  
તરીકે જાહેરતા થયેલા શ્રીયુત 'બાલાપ્પા ચંદ્રાપ્પા ધાવતે'  
મુજ્યું હતા.

પ્રવચનમાં પાછળથી શ્રી 'ધાવતે' તરફથી બાળદીક્ષા  
સંબંધી પુછ્યા : સમય થોડો હોવાથી, પૂ.  
આચાર્યએ બાળદીક્ષા સંબંધી પ્રશ્નોનો વિષય પણ ઘણો  
જ ઝડપથી ચચ્ચો હતો : એટલે તેમાંના ઘણા થોડા  
ભાગનું અવતરણ જ લઈ શકાયું છે. બાળદીક્ષા સંબંધી  
વિરોધી સાહિત્ય વાંચવાના કારણે વિપરીત વિચારના  
બનેલાઓ ઉપર પણ આ વ્યાખ્યાનની ઘણી જ સરસ  
અસર થઈ હતી. ગુજરાતી નહિ સમજ શકનારાઓ  
આજે ઘણા હોવાથી આજનું પ્રવચન હિન્દી ભાષામાં થયું  
હતું. અતે નીચે તેનું સારભૂત ટૂક અવતરણ આપવામાં  
આવે છે.

## બાળકોની ચારિત્રની ઈચ્છા :

સભા : બાળકોને દીક્ષા અપાય છે તે એમની ઈચ્છાથી કે બળાત્કારથી ?

ઈચ્છા વિના કોઈને દીક્ષા આપી શકાય છે ?

સભા : બાળકને ઈચ્છા ક્ર્યાંથી થાય ?

તમે પુનર્જન્મને માનો છો કે નહિ ? જો હા, તો પૂર્વજન્મના સંસ્કારોના યોગે આ જન્મમાં પણ અમુક અમુક પ્રકારની ઈચ્છાઓ પેદા થવાનો સંભવ છે, એમ તમારે માનવું જ પડશે. પૂર્વજન્મના તેવા કોઈ સુંદર સંસ્કારોના યોગે આ જન્મમાં નાની ઉંમરે પણ ચારિત્ર લેવાની ઈચ્છા થવી, તે સ્વાભાવિક છે. આત્મા લઘુકમ્બા બન્યો હોય, આ જન્મમાં કોઈ સાચા હિતકારી માતા-પિતાના યોગને પામ્યો હોય અને જન્મથી જ સુંદર સંસ્કારોમાં ઉદ્ઘયો હોય, તો તેવા બાળકને ચારિત્રની ઈચ્છા થવી, એ કોઈ અસ્વાભાવિક વસ્તુ નથી.

આપણે પહેલાં જ વિચારી આવ્યા છીએ કે સમ્યગ્દર્શનાદિ એ આત્માના ગુણો છે અને તે ગુણો તેને આવરનારાં કર્માનો ક્ષયોપશમાદિ થતાં પ્રાણે છે. સમ્યક્કારિત્ર પણ તેને આવરનારા કર્મના ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થાય છે. જે આત્માઓનાં તેવા પ્રકારનાં કર્મનો ક્ષયોપશમ થયો નથી, તે આત્માઓમાં ચારિત્રનાં વાસ્તવિક પરિણામો ઉત્પન્ન થતાં જ નથી. આથી જ, સમર્થ જ્ઞાનીઓએ ફરમાવું છે કે- ‘કર્મના ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થતાં ચારિત્રની સાથે બાલભાવને કશો પણ વિરોધ નથી.’ જે કે જ્ઞાનીઓએ એ વાત પણ સ્પષ્ટપણે જણાવી જ છે કે ‘આઠ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પ્રાયઃ તેવા ક્ષયોપશમભાવને પામતાં નથી.’ આઠ વર્ષથી અંદરની વયવણાઓને ચારિત્રનાં તેવાં પરિણામો પ્રાયઃ ઉત્પન્ન થતાં નથી, એથી આઠ વર્ષથી ઓછી ઉંમરે ચારિત્ર દેવાનો વિધિ આ શાસનમાં નથી. જે કે કવચિત્ તદ્દન નાની વયમાં પણ તેવો ક્ષયોપશમભાવ થઈ જતાં ચારિત્રના સુંદર પરિણામો આવી જાય છે, પણ બહુધાં શરીરાવસ્થા આઠ વર્ષની વય થાય તે પહેલાં તેવો ક્ષયોપશમભાવ થતો નથી. કર્મના ક્ષયોપશમભાવને વય સાથે

કશો સંબંધ નથી : કારણ કે વૃદ્ધ ઉમરે પણ ઘણાઓને ચારિત્રનાં પરિણામો થતા નથી. આથી - ‘આઈ વર્ષની ઉમરના બાળકને દીક્ષા લેવાની ઈરદ્દી ન જ થાય.’ - એમ માનતું તે અયથાર્થ જ છે.

## લગ્ન સાથે દીક્ષાને સરખાવાય નહિ :

સભા : નાની ઉમરે દીક્ષા લેનાર વયમાં આવ્યા પછી ઘેર જવાનો સંભવ છે.

મહાપુરુષોનો અનુભવ એવો છે કે બાલદીક્ષિત કરતાં યુવાનવયને ભોગમાં પસ્તાર કર્યા પછી દીક્ષા લેનાર માટે પતનનો સંભવ વધારે છે.

સભા : બાલલગ્ન જેમ ઈષ્ટ નથી, તેમ બાલદીક્ષા પણ વ્યાજબી લાગતી નથી.

કારણ કે જીવનનો આદર્શ જેવો જોઈએ તેવો સમજાયો નથી. જીવનનો આદર્શ યથાર્થપણે જેઓને સમજાયો છે, તેઓ તો બાલદીક્ષાને હાનિકર નહિ, પરંતુ પરમ હિતકર જ માને છે. લગ્ન એ જીવનનો આદર્શ નથી, જ્યારે દીક્ષા એ જીવનનો આદર્શ છે. ‘લગ્ન કર્યા વિના માણસ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે જ નહિ અને આ જીવનમાં પામવા લાયક ઉત્તમ ગુણોને પામી શકે જ નહિ’ - એવું કાંઈ જ નથી : જ્યાર દીક્ષા માટે એમ જરૂર કહી શકાય કે ‘આ જીવનને ઊંચામાં ઊંચી કોઈનું બનાવવું હોય તો દીક્ષા વિના ચાલી શકે જ નહિ.’ દીક્ષિત જીવનને પામવાની સાચી કામના પ્રગટ્યા વિના માણસમાં સાચી મહાપુરુષ બનવાની લાયકાત જ આવતી નથી અને દીક્ષાને ગ્રહણ કરીને રેનું યથાર્થ પાલન કરવામાં પ્રયત્નશીલ બનેલો આત્મા જ સાચો મહાપુરુષ બની શકે છે. દીક્ષા જેમ પરમ કલ્યાણનું પરમ કારણ છે, તેમ લગ્ન તો ઊલદું આત્માને આત્માના ગુણોને પ્રગટાવવાના પ્રયત્નમાં નડતરરૂપ થવાનું પરમ કારણ છે : એટલે ખરી વાત તો એ છે કે લગ્નની સાથે દીક્ષાને જ સરખાવવી, એ અવિચારીપણું છે.

શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસરને માનનારો બાલદીક્ષાનો પ્રમાણિકપણે વિરોધ કરી શકે નહિ :

જેઓ શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસરને માન્ય રાખે છે, તેઓથી પ્રમાણિકપણે તો બાલદીક્ષાનો વિરોધ થઈ શકે તેમ છે જ નહિ.

શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણ માણસના જીવન ઉપર ધડી જ અસર નિપણવે છે. બાળપણથી ખરાબ શિક્ષણ મળ્યું હોય, ખોટા સંસ્કારો મળ્યા હોય અને ખરાબ વાતાવરણમાં જ ઊછરવાનો યોગ પ્રાપ્ત થયો હોય, તો સારું નીવડે એવું પણ બાળક ઘણું જ ભયંકર નીવડે છે, એ તો દુનિયાના અનુભવની વાત છે. જો શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસર જ ન થતી હોય, તો આજે પાશ્વાત્ય શિક્ષણ, પાશ્વાત્ય સંસ્કારો અને ત્યાંના વિલાસી વાતાવરણ સામે જે ટીકાઓ થઈ રહી છે, તે ન થતી હોત.

કુશિક્ષણ, કુસંસ્કાર અને કુવાતાવરણમાં ગમે તેવો જીવ પણ બુગડે છે, એવું માનનારાઓ જ્યારે બાલદીક્ષાનો વિરોધ કરવા તત્પર બને છે, ત્યારે કહેતું પડે છે કે તેઓ કાં તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી અને કાં તો અપ્રમાણિકપણે વિરોધ કરે છે.

આઠ-દશ વર્ષની ઉભરે દીક્ષિત બનેલ બાળક યુવાન વય આવતાં પહેલાં તો એવા સુંદર શિક્ષણને પ્રાપ્ત કરી શકે છે, કે જેથી યુવાન વયે તે ભોગ તરફ ખેંચાવાને બદલે આત્મવિભૂતિને પ્રગટાવવામાં જ પોતાનું સઘણું સામથ્ય બર્ચનારો બને. વિષયોની વિષમતાનો અને ભોગોની ભયંકરતાનો એ આત્માને એટલો તો સરસ ખ્યાલ આવી ગયો હોય કે શ્રી જિનવાણીથી ભાવિત બુદ્ધિવાળો બનેલો તે યુવાન વયના કારણે પણ વિષયો કે ભોગો તરફ ખેંચાઈ જાય નહિ.

બાલદીક્ષિત યુવાન વયમાં આવતાં પહેલાં અધ્યાત્મવિદ્યાના શિક્ષણને વર્ષો સુધી મેળવનારો બન્યો હોય, આત્મસાધનાના સુંદર સંસ્કારોને પામ્યો હોય અને આત્મસાધકોના વાતાવરણમાં ઊછયો હોય, એટલે એવો આત્મા તો યુવાન વયે પરમ વિવેકશીલ બની ગયો હોય : અને સાચો વિવેકી તો સંસારના ભોગો તરફ દૃષ્ટિ પણ કરે નહિ એ સ્વાભાવિક જ છે.

**કર્મનો યોગે પતનનો સંભવ બન્નોને માટે સરખો જ છે :**

હવે કર્મના યોગે એટલે વેદોદયના કારણે પતન થવાનો સંભવ છે એમ કહો, તો તેવો સંભવ તો જેમ અભુક્તભોગી બાલદીક્ષિતો માટે છે,

તેમ ભુક્તભોગી દીક્ષિતો માટે પણ છે : કારણ કે ભોગમાં યુવાન વયને પસાર કરવાના કારણો, વેદોદ્યના કારણભૂત કર્મ નાચ થઈ જાય છે એમ તો છે જ નહિએ : એટલે જ્યાં સુધી તેવું કર્મ છે ત્યાં સુધી પતનનો સંભવ તો અભુક્તભોગી અને ભુક્તભોગી બન્નો માટે સરળો જ છે.

આજે કેટલાક ઘણી મોટી ઉંમરના માણસો પણ વિષયભોગોની પાછળ પાગલ બનેલા જોવાય છે અને એવા પણ યુવાનો વિદ્યમાન છે, કે જેઓ સુંદર પ્રકારના બ્રહ્મચર્યનું પાતન કરે છે. આથી યુવાન વયને ભોગોના ભોગવટામાં પસાર કર્યા પછીથી દીક્ષા લેવામાં પતનનો સંભવ નથી એમ કહી શકાય તેમ નથી, કારણ કે યુવાન વયે ભોગોના ભોગવટામાં પસાર કરવી એ કાંઈ વેદોદ્યના કારણભૂત કર્મને નાચ કરવાનો ઉપાય નથી.

## કૌતુક આદિ દોષોનો સંભવ બાલદીકિતો કરતાં ભુક્તભોગી દીક્ષિતોને વધારે છે :

એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે ભોગોનો ભોગવટો એ ભોગવૃત્તિને શમાવવાનો ઉપાય નથી. ભોગોના ભોગવટાથી તો પ્રાયઃ ભોગવૃત્તિ ઉત્તેજિત બને છે. સામાન્ય રીતે કામવૃત્તિ તેના સેવનથી વૃદ્ધિ પામનારી હોય છે. આથી કામવૃત્તિને સંયમમાં લેવી અને તેની ઈરથા ન જન્મે એવા વાતાવરણમાં રહેતું એ જ હિતકારક છે. ભોગો ભોગવીને દીક્ષા લેનારાઓ માટે તો આ જન્મનો અભ્યાસ તાજો હોવાથી તે તરફ દોરાઈ જવાનો સંભવ રહે છે, જ્યારે બાલદીકિતોને માટે તો કૌતુક આદિ દોષો જન્માવાનું તે કારણ પણ નથી : કારણ કે આ જન્મમાં તેવા પુષ્યાત્માઓને તેવો ખરાખ અભ્યાસ થયો નથી અને પૂર્વજન્મમાં જે થયું હોય તે તો દૂર છે. આ રીતે જોતાં પણ, ભુક્તભોગી દીક્ષિતોના કરતાં બાલદીકિતોને માટે પતનની સંભાવના ઓછી છે.

## બાલદીકિતોમાંથી પતિત ઓછા થાય છે અને પ્રભાવક અધિક બને છે :

બાલદીકાળમાં દીક્ષિત બનીને સુગુરુની નિશ્ચામાં જીવનને ઘડનારાઓ પતિત ઓછા બને છે અને પ્રભાવક અધિક બને છે. બાળકના જીવનને

ઘડનાર જે યોગ્ય મળી જાય અને બાળકની ભવિતવ્યતા સુંદર હોય, તો પ્રાયઃ એ મહાન પ્રભાવક બન્યા વિના રહે નહિ. બાળક જે રીતે સંસ્કારોને જીલી શકે છે અને અભ્યાસમાં દત્તચિત્ત બની શકે છે, તે રીતે જિંદગીનો અડધો ભાગ વિષય-કષાયની સાધનામાં ગાળનારો પ્રાયઃ સંસ્કારોને જીલી શકતો નથી અને અભ્યાસમાં પણ તેવો દત્તચિત્ત બની શકતો નથી.

દુનિયામાં પણ શિક્ષણની શરૂઆત બાલ્યકાળથી જ કરવામાં આવે છે. મોટી ઉમરે જે શિક્ષણની શરૂઆત કરવામાં આવે, તો તેમાંથી શિક્ષણના ઊંડાણને પામનારા ઓછા નીકળે છે. દુનિયાદારીમાં જે જે પદોને મોટાં ગણવામાં આવે છે, તે તે પદોને પામનારા બાલ્યકાળથી જ શિક્ષા પામેલાઓ હોય છે અને વર્ષોના શિક્ષણ બાદ તૈયાર થયેલા હોય છે. એ જ રીતે અહીં ધર્મશાસ્ત્રનમાં પણ મહાપુરુષો બાલકીક્ષિતો વધુ પ્રમાણમાં બની શક્યા છે : કારણ કે બાલ્યકાળથી ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર તેઓને મળે છે. એના યોગે તે પુણ્યત્માઓ યુવાન ઉમરે પહોંચતાં સુધીમાં તો એવા વિવેકી અને સુપરિષ્ણિત બની જાય છે કે તેઓ પોતાના જીવનને ઉજાળવા સાથે બીજા પણ સંખ્યાબંધ આત્માઓના તારક બની જાય છે.

## જોખમ ક્યાં નથી ?

આમાં પણ અપવાદ જરૂર હોય. કોઈ પદેય ખરા, પણ પતનના સંભવ માત્રને બહાને સંન્માગને રોકાય નહિ. ‘જેટલા વ્યાપાર કરે એટલા કમાય જ’ - એવો નિયમ નહિ : ‘જેટલા નિશાળે ભણવા બેસે તે બધા વિદ્વાન જ થાય’ - એવો નિયમ નહિ : ‘પરીક્ષામાં બેસનારા બધા પાસ જ થાય’ - એવો નિયમ નહિ : અને મુસાફરી કરનારા બધા સુખરૂપ મુસાફરી પૂરી કરી જ શકે’ - એવો નિયમ નહિ : બધેય જોખમ તો છે જ. વ્યાપારમાં ખોટ જવાનું, ભાડાનારને પરીક્ષામાં નાપાસ થવાનું અને મુસાફરીમાં જનારને જિંદગીનું જોખમ તો છે જ : છતાં દુનિયાને તે માર્ગ રૂચ્યો છે અથવા તો કહો કે તે દ્વારા નિષ્પન્ન થતી વસ્તુનું અર્થીપણું છે, માટે એની સામે કોઈ બોલતું નથી. પરીક્ષામાં નાપાસ થનારા કેટલાય આપધાત કરે છે, વ્યાપારમાં ખોટ કરનારા કેટલાય જેર ખાય છે ને મુસાફરી

કરનારા કેટલાય અકસ્માતના ભોગ બની અકાળે મૃત્યુ પામે છે : છતાં તે માર્ગો બંધ કરવાનું કોઈ કહેતું નથી અને ‘બાલદીક્ષિતોને પડવાનો સંભવ છે’ - એમ કહીને બાલદીક્ષાના માર્ગને બંધ કરવાનું કહેવાય છે, એ ઓછી વિવેકહીનતા છે ? પણ ખરી વાત તો એ જ છે કે અજ્ઞાન દુનિયાને કેવળ અર્થ અને કામ જ ગમે છે. ધર્મની આરાધનાનો આદર્શ વસ્તુતઃ રુચ્યો નથી અને એથી જ બાલદીક્ષાનો અને બાલદીક્ષાને નામે સમગ્ર દીક્ષાનો પણ વિરોધ કરાય છે !

### સમ્યક્યારિતાનો સદ્ભાવ :

આજનો શ્રીમંત પાપોદયથી ગરીબ પણ થઈ જાય, હોશિયાર વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ પણ થઈ જાય, એ રીતે સમજુનું પણ પાપના યોગે પતન થઈ જાય, એમાં આશ્વર્ય નથી. એ રીતે બુઢ્ણા, જુવાન કે બાળક દરેકનું પતન થવું સંભવિત છે : પરંતુ સામાન્ય રીતે તો મોટા માટે જેટલો ભય છે તેટલો નાના માટે નથી.

માતા-પિતાની સંમતિ હોય અને બાળકની પ્રવૃત્તિ પણ શુભ દેખાતી હોય, તો એને ગીતાર્થ ગુરુઓ જરૂર દીક્ષા આપી શકે છે. દુનિયાદરીની સાધનામાં તો બાળકોને બલાત્કારે પણ યોજાય છે : જ્યારે દીક્ષામાં તો નિયમ જ છે કે સોળ વર્ષની અંદરની વયના કોઈ પણ બાળકને દીક્ષા આપવી હોય તો તે બાળકની ઈચ્છા પણ જોઈએ અને તેના વાલીની સંમતિ પણ જોઈએ. આ શાસનમાં મોટા કરતાં નાનાની લાયકાત અધિક મનાઈ છે. પૂર્વકાળમાં કે આજે પણ નાની ઉંમરમાં નીકળેલા જ મોટે ભાગે પ્રભાવક બન્યા છે અને બને છે. પૂર્વજન્મની આરાધનાના યોગે હજારોમાં એકાદ બાળકને દીક્ષાની ઈચ્છા થાય છે. એને પણ રોકવાનો એક જાતિનો મેનિયા આજે અજ્ઞાન આત્માઓને વળ્ગયો છે.

બુક્તભોગીને પડવાનાં નિમિત્તો ઘણાં છે અને અભુક્તભોગીને બહુ થોડાં છે, એમ શાસ્ત્ર કહે છે : એટલા માટે બાળવયના ત્યાગનો મહિમા ઘણો મોટો છે. ગૃહસ્થાશ્રમને ધર્મ માનવાની ધેલછા કરનારાઓએ પણ બાલબ્રહ્મયારીઓનો મહિમા ખૂબ ગાયો છે ! એટલે બાલદીક્ષા વસ્તુતઃ કોઈ પણ રીતે વિરોધપાત્ર છે જ નહિ.

‘પાપબુદ્ધિ ચાલી જાય અને પાપનો ત્યાગ થઈ જાય, તો જ મનુષ્યજીવનની સારી સફળતા સધારણ’-એવું જો સમજાઈ જાય, તો પાપના સર્વથા ત્યાગરૂપ દીક્ષા પ્રત્યે આદરભાવ પ્રગટ્યા વિના રહે જ નહિ. જ્યાં સુધી સમ્યક્કારિત્ર પ્રત્યે સાચો સદ્દ્ભાવ પ્રગટશે નહિ, ત્યાં સુધી સાચા સુખની સાધના થઈ શકશે નહિ : માટે યોગ્ય ગુરુઓનો સહવાસ સાધીને સાચા હિતકર માગને સમજવા માટે તથા આરાધવા માટે પ્રયત્નશીલ બનો, એ જ એક શુભાભિલાષા.

\* \* \*

સન્માર્ગ પ્રકાશનનું એક આગવું પ્રકાશન

## સમ્યગ્દર્શન

૪૫૦ પેજ, ભારે કાગળો, ઓફસેટ પ્રી-ટીંગ, પાકુ બાઈન્ડિંગ.  
મૂલ્ય રૂ. ૧૦૦-૦૦

: પ્રવચનકાર :

પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદિવ શ્રીમદ્ વિજય  
રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. આ ત્રૈભાં પણ સમ્યગ્દર્શન પાયાનું કામ કરે છે. સમ્યગ્દર્શન વિનાના ગમે તેવા ઉંચા શાનની અને ચારિત્રની શાસ્ત્રે છેંમત આંકી નથી. આટલું બધું સમ્યગ્દર્શનનું મૂલ્ય છે.

આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ-એની મહત્ત્વા, એની પ્રાપ્તિ સંરક્ષણ અને શુદ્ધિના ઉપાયો, એનાં દૂષષ્ઠો તથા એની પ્રાપ્તિ આદિનો કમ વગેરે સધળીય બાબતોને અત્યંત સરળ, રસાળ, તત્ત્વપ્રચુર ભાષામાં પૂજ્યશ્રીએ અનેક પ્રવચનોમાં વર્ણવી છે. એ પ્રવચનોને સંકલિત કરીને આ પુસ્તકમાં પ્રકાશિત કરાયા છે. આજસુધી ગુજરાતી બે આવૃત્તિ અને હિંદી આવૃત્તિમાં છપાયા બાદ હવે આ ગુજરાતી ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થાય છે, એજ એની મહત્ત્વાને સાખીત કરે છે. સમ્યગ્દર્શનના ઊંડા અર્થાજનોમાં અત્યંત સન્માનનીય સ્થાન પામનાર આ પુસ્તક, સમ્યગ્દર્શનના વિષયને ઊંડાણથી જાણવા-સમજવાના ઈચ્છુક દરેક જિશાસુએ અવશ્ય વાંચવું જ રહ્યું.

## બાળદીક્ષા શ્રાવકપણા સાથે જડાયેલી છે :

દીક્ષાનો જે વિરોધી હોય તે તો વસ્તુતઃ શ્રાવક નથી. એવાઓના ટોળાને પચીસમા તીર્થકરસ્તવરૂપ શ્રીસંઘ તે જ માને, કે જે પોતે મિથ્યાત્વથી ઘેરાએલો હોય. દીક્ષાની ભાવના શ્રાવકપણાની સાથે જડાયેલી જ છે અને એથી એવી સારી ચીજ વહેલી ન લેવાય તો શ્રાવક પોતાને ઠગાયેલો માને, એમાં નવાઈ નથી. જે વસ્તુ એકાંતે કલ્યાણકરી છે, તે તો જેમ બને તેમ વહેલી પામવાની જ ભાવના હોય. પોતાનાથી ન પમાય તો પણ બીજાઓને બાલવયે પામતા જોઈને આનંદ જ થાય. યોગ્ય ગુરુના હાથે અધિકારીને બાલવયે અપાતી દીક્ષામાં આડે આવનારાઓ અને એ માટે ખોટો પ્રચાર કરીને રાજ્ય દ્વારા અટકાયત કરવાનો પ્રયત્ન કરનારાઓ, જૈનકુળમાં પાડેલા ભયંકરમાં ભયંકર પાપાત્માઓ છે : અને જે વેષધારિઓ એવાઓને ઉતેજન આપે છે, તે અધમો માટે તો કહેતું જ શું ?

## બાલદીક્ષા એ અપવાદ માર્ગ નથી :

બાલદીક્ષા, એ અપવાદમાર્ગ નથી, પણ એ એક એવો માર્ગ છે કે જે માર્ગે નહિ જઈ શકનારો સુશ્રાવકો અફ્સોસ જ કરે અને પોતે બાલપણમાં દીક્ષા ન પામી શક્યા, એને પોતાની એક કમનસિબી જ માને. જનતાને કે ગંભીરી આઠ વર્ષ અને તે પછી થનારી દીક્ષાને, વયની અપેક્ષાએ અપવાદમાર્ગની દીક્ષા કહેનારાઓ પણ અજ્ઞાન જ છે. ‘ભોગ ભોગવ્યા વિના ન જ જવાય, વગર ભોગ ભોગવ્યે જય તે પટકાય જ, રાજમાર્ગ ભોગ ભોગવ્યા પછી જ દીક્ષા લેવાનો છે’ - આવું આવું બોલનારાઓની અકલ ઠેકાણે નથી. પડવાનો ભય કોને ? એમ બોલવું તે બુદ્ધિનો સદ્ગુપ્યોગ નથી, પણ બુદ્ધિનું લીલામ છે.

## પડવાનો ભય કોને ?

પડવાનો સંભવ, બાલવયે દીક્ષિત થનારાઓ કરતાં ભોગ ભોગવવામાં, યૌવનવયને પસાર કરીને તે પછી દીક્ષા લેનારાઓ માટે જ વધારે છે. ‘અભુક્તભોગી કરતાં ભુક્તભોગીને માટે પડવાનો સંભવ વધારે છે’ - એમ ઈતર દર્શનમાં વર્ષો સુધી રહેનાર, ઈતર દર્શનશસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન અને શ્રી જૈનદર્શનનાં શાસ્ત્રોનું રહસ્ય પામીને સમર્થ જૈન

શાસ્ત્રકાર બનેલા સુવિહિત શિરોમણિ આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે.

## બાલદીક્ષા અને સંસ્કરણ :

બાલવયે દીક્ષિત થનારાઓ, બાલવયથી જ સ્વાધ્યાયમાં રત બની જાય છે, એટલે યુવાનવય આવતાં સુધીમાં તો તેમના આત્માઓ એટલા બધા સુસંસ્કારિત બની ગયા હોય છે કે તેમને દુનિયાની વાસનાઓ આકર્ષી શકતી નથી, પાડી શકતી નથી અને અથી પાડી પણ શકતી નથી. કવચિત્તુ તીવ્ર મોહોદ્ય થઈ જાય અને તેના યોગે પતન પણ થઈ જાય, તો તે એક જુદી જ વાત છે : બાડી સંસ્કાર, શિક્ષણ અને વાતાવરણ હિંસક પશુઓની પણ હિંસકવૃત્તિને ફેરવી નાખી શકે છે, તો બાલદીક્ષિતો ઉપર સંસ્કાર, શિક્ષણ અને વાતાવરણની અસર ન થાય, એ કેમ બને ? હિંસક સ્વભાવનાં પશુઓ પણ કેવાં સંસ્કારી બની જાય છે, એની સરકસ જેનારાઓને ખબર નહિ હોય ! છે જ, તો પછી સંયમના સંસ્કાર, સંયમનું શિક્ષણ, સંયમનું જ વાતાવરણ અને સંયમની જ કિયાઓમાં રોજ લાગ્યા રહેવાનું આ બધાની અસર થાય નહિ અને બાલદીક્ષિતોનું પતન થયા વિના રહે જ નહિ, આવું માનનારા અને બોલનારા શું ઉહાપણવાળા છે ? નહિ જ. વળી એવું જેઓ બોલે છે, તે બાલદીક્ષિતો વિરાધનાના ઘોર પાપમાં પડે તે ઠીક નહિ, એવી બુદ્ધિએ બોલે છે એમ ? નહિ જ, કારણ કે તેઓ જો વિરાધનાથી ઉરતા હોત, તો તેઓ જ્ઞાનિઓની આજ્ઞાને સમજવાનો પ્રયત્ન કર્યા વિના રહ્યા હોત નહિ.

બાલવયે દીક્ષિત થયેલા પુણ્યાત્માઓએ, વિષયભોગોનો ઉપભોગ નહિ કરેલો હોવાથી, તેનું સ્મરણ થવાનો અને તેવા સ્મરણના યોગે તે ભોગો તરફ આકર્ષિત જવાનો પણ તેમને માટે ભય નથી ! જ્યારે ભુક્તભોગિઓ માટે તો તે પણ ભયનું કારણ છે : બાલવયમાં જે રીતએ શુભ સંસ્કારોને જીલી શકાય છે, તે રીતએ યુવાનવય ભોગો ભોગવવામાં જ વ્યતિત કરીને દીક્ષિત થનારાઓ શુભ સંસ્કારોને પ્રાય : જીલી શકતા નથી : કારણ કે વર્ષોનાં અયોગ્ય આચરણોના સંસ્કાર તેમનામાં પડેલા હોય છે. શિક્ષણ જેવું બાલવયથી જ લેવા માંડેલું હોય અને ખીલે છે, તેવું મોટી વયે દીક્ષા લે તેનામાં ઓછું ખીલે છે.

## પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરી સ્મૃતિ ગ્રંથમાળા

- \* માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળમાં સન્માર્ગ પ્રકાશન રજૂ કરે છે.  
- પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો.
- \* સતત પાંચ વર્ષ સુધી પૂ. ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વગરોહણ તિથિએ એક સાથે ૨૧, ૨૨, ૨૨, ૨૨, ૨૧ કુલ ૧૦૮ પુસ્તકાઓની વિમોચન વિષિ થશે.
- \* પ્રથમ વાર્ષિક તિથિ... વિ.સં ૨૦૪૮ અધાઢ વદ ૧૩+૧૪ તા. ૨૮-૭-૯૨ને અનુલક્ષીને બે આવૃત્તિમાં પ્રકાશિત થયેલ એકવીસ પુસ્તકો.
 

૧. સુખની ચાલી	૧૨. સિદ્ધિસાધક સાધના
૨. ઈદ્ઘાસિના ઉપાયો	૧૩. બ્રહ્મચર્ય
૩. સંતોષ એટલે શું ?	૧૪. મમતા
૪. યુવાનીની સફળતા	૧૫. આંધળાને આરસી (મોદીની વાત)
૫. ઊગતી પ્રજાના ઘડવૈયાઓને	૧૬. અરિહંત થનારા આત્માઓ
૬. માનવનું કર્ત્વ	શ્રી ધના સાર્થવાહ અને શ્રી નયસાર
૭. માનવજીવનની સાર્થકતા	૧૭. રાજર્ષિ કુમારપાણ
૮. જીવનમાં ધર્મની જરૂર	૧૮. અણુમાંથી મેરુ (શ્રી શાલિબ્રદ)
૯. ધર્મનું રહસ્ય	૧૯. મેરુમાંથી અણુ (શ્રી ઝંગરિયા મુનિવર)
૧૦. સફળતાનો માર્ગ	૨૦. ટણતા સૂરજનો સોનેરી પ્રકાશ-૧
૧૧. જૈન ધર્મની આધેરી જલક	૨૧. ટણતા સૂરજનો સોનેરી પ્રકાશ-૨
- \* દ્વિતીય વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૪૮ અધાઢ વદ-૧૪ તા. ૧૮-૭-૯૨ના રવિવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ
 

૧. જીવ અને જગત	૧૨. મૃત્યુ બને મંગળ
૨. પ્રગતિનાં મંડાજી	૧૩. અઢાર સદાચાર
૩. વિશ્વધર્મ	૧૪. રોહગુપ્ત અને સિદ્ધસેન
૪. ભાવના એક રસાયણ	૧૫. જૈનધર્મ એટલે સો ટચનું સૌંનું
૫. ચાંપો વાણિયો	૧૬. સાદ્વાદ
૬. પાત્ર સુવર્ણનું પાન સુરાનું	૧૭. જૈનશાસન એક અરીસો
૭. સુખ અને સુખનો માર્ગ	૧૮. આત્મા અને મોક્ષ
૮. સાચું સુખ ક્યાં ?	૧૯. રાજ વસુ
૯. સંસાર અસાર છે.	૨૦. જ્યવંતી જિનાજી
૧૦. મહાત્મા ઈલાતીપુત્ર	૨૧. અસ્પૃશ્યતા અને શ્રી જૈનશાસન
૧૧. એકમાત્ર શરરજી	૨૨. વિનય, માતા-પિતાનો

કિંમત : કોઈપણ એક પુસ્તક રૂ. ૭-૦૦

પહેલા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ બીજા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦

પુરાં એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ. ૬૨૫-૦૦

Phone : ૦૭૯-૨૪૩૫૪૦૫

## પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરી સ્મૃતિ ગ્રંથમાળા

- \* માત્ર પાંચ જ વર્ષના ટુંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજૂ કરે છે.  
- પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો.
  - \* સતત પાંચ વર્ષ સુધી પૂ. ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગરોહણ તિથિએ એક સાથે ૨૧, ૨૨, ૨૨, ૨૨, ૨૧ કુલ ૧૦૮ પુસ્તકોની વિમોચન વિધિ થશે.
  - \* તૃતીય વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૫૦ અધાર વદ-૧૪ તા. ૬-૮-૬૪ને શનવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ
- |                                |  |
|--------------------------------|--|
| ૪૪. આત્મસેવા                   | ૪૫. ગુરુવચનનો મહિમા                      |
| ૪૫. કામના અને સિદ્ધિ           | ૪૬. તેર અંતરશન્તુઓ                       |
| ૪૬. પ્રગતિની દિશા              | ૪૭. વિષિમાર્ગની સ્થાપના                  |
| ૪૭. ઉન્તિના ઉપયો               | ૪૮. બીજાનું કરી છૂટો !                   |
| ૪૮. લોકપ્રિયતા                 | ૪૯. વાણીનો વપરાશ                         |
| ૪૯. શેઠ સુદર્શન                | ૫૦. દુઃખમાં દીનન બનો ! સુખમાં લીનન બનો ! |
| ૫૦. સદાચાર                     | ૫૧. આવક-જાવકના સાચા-ખોટા માર્ગો          |
| ૫૧. ઉદારતા                     | ૫૨. સતત વસન                              |
| ૫૨. લોકપવાદ                    | ૫૩. માંસ : આધાર કે સંહાર                 |
| ૫૩. દશ દિશાંતે દુર્લભ માનવજન્મ | ૫૪. જિનપૂજા અને તેનું ફળ                 |
| ૫૪. સાચો જરેરી                 | ૫૫. શ્રેષ્ઠપુત્ર સુભાત                   |
- \* ચચુર્થ વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૫૧ અધાર વદ-૧૪ તા. ૨૨-૭-૬૫ને ભુધવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ
- |                                      |  |
|--------------------------------------|--|
| ૫૬. સાધ અને સાધન                     | ૭૭. મુક્તિનું થેય : સાચું શ્રેય :          |
| ૫૭. દ્ધર્મમાં ભાવની અનિવાર્યતા       | ૭૮. રલત્રચીરૂપ તીર્થ                       |
| ૫૮. શ્રદ્ધાદીપ                       | ૭૯. સૌને ગમતા સુખનું મૂળ                   |
| ૫૯. ધાર્મિક શિક્ષણ અને પાઠથાળા       | ૮૦. સાચો શિષ્ય ‘અંગર્ણ’                    |
| ૬૦. સાધમિક વાતસલ્ય                   | ૮૧. શેતાંબર અને દીંગંબર વર્ચેનો તફાવત      |
| ૬૧. જૈનત્વની સફળતાનો પાયો            | ૮૨. ગ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? |
| ૬૨. સાધુધર્મ અને ગૃહસ્થધર્મ          | ૮૩. તારનાર પણ તારે કોને ?                  |
| ૬૩. શ્રમજી જીવનની શ્રેષ્ઠતા          | ૮૪. સાદ અંતરનો : નાદ મુક્તિનો :            |
| ૬૪. જૈન દીક્ષા માટે સ્વજનોની         | ૮૫. ચિત્તા અને આત્મચિત્તા                  |
| સંઘતિ આવશ્યક ખરી ?                   | ૮૬. ધર્મરક્ષણ                              |
| ૬૫. જૈન દીક્ષા અંગે પત્રકારોનું વલભા | ૮૭. ધર્મ કલારે અને કોને અપાય ?             |
| ૬૬. જગતનું જવાહીર જૈનાચાર્ય          |  |

કિંમત : કોઈપણ એક પુસ્તક રૂ. ૭-૦૦

ગ્રીજા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦. ચોથા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦

પૂર્ણ એકસો આડ પુસ્તકોનો સેટ રૂ. ૬૨૫-૦૦



૭૫

